

"વિના સહકાર નહિ ઉદ્ધાર"

સેવા.....

સહકાર.....

સંગઠન.....



રજી.નં.સે. ૧૦૪ તા. ૦૬-૧૦-૧૯૬૦

સ્થાપના વર્ષ : ૧૯૬૦

VADNAGAR NAGRIK SAHAKARI BANK LTD.



૬૬ મો વાર્ષિક અહેવાલ - ૨૦૨૫-૨૬

આર.બી.આઈ. લાયસન્સ નં ચુ.બી.ડી.જી.યુ.જે. ૦૦૩૭ પી. તા ૧૨-૧૦-૦૯

વાર્ષિક સાધારણ સભા

તારીખ : ૨૮-૦૬-૨૦૨૬, રવિવાર

સમય : સાંજના ૦૫-૦૦ કલાકે



ચેરમેન

શ્રીમતી સરલાબેન દલસુખભાઈ પટેલ

વાઈસ ચેરમેન

શ્રી દિનેશકુમાર રમણલાલ પટેલ

વડનગર નાગરિક સહકારી બેન્ક લિમિટેડ

ઠે. નાની માતોર, વડનગર - ૩૮૪ ૩૫૫ (ઉ.ગુ.) મો. ૯૩૧૬૫ ૬૫૮૧૫

E-mail : info@vadnagarbank.com Website : www.vadnagarbank.com

❀ બોર્ડ ઓફ ડીરેક્ટર્સ ❀



શ્રીમતી સરલાબેન દલસુખભાઈ પટેલ
ચેરમેનશ્રી
(અર્જુનભારી પરામાં, વડનગર)
મો. ૬૩૫૨૨ ૫૯૨૨૦



શ્રી દિનેશકુમાર રમણલાલ પટેલ
વાઈસ ચેરમેન
(પિઠોરી દરવાજો, વડનગર)
મો. ૯૪૨૭૪ ૬૬૯૦૫



શ્રી શંકરભાઈ ઝીણાલાલ પટેલ
ડિરેક્ટરશ્રી
(ગાયત્રી સોસાયટી, વડનગર)
મો. ૬૩૫૩૪ ૩૫૧૧૪



શ્રીમતી સુનિતાબેન દિલીપભાઈ જયસ્વાલ
ડિરેક્ટરશ્રી
(ખારીવાસ, અમતોલ દરવાજો, વડનગર)
મો. ૯૪૨૬૪ ૪૧૧૩૩



શ્રી પોપટલાલ દલસુખભાઈ શુખડીયા
ડિરેક્ટરશ્રી
(બજાર, વડનગર)
મો. ૮૫૧૧૬ ૪૩૫૬૪



શ્રી પોપટભાઈ લક્ષ્મણભાઈ મોદી
ડિરેક્ટરશ્રી
(ગાંસકોળ, વડનગર)
મો. ૯૪૦૮૩ ૮૬૪૩૨



શ્રી વિનોદચંદ્ર બુધાલાલ પટેલ
ડિરેક્ટરશ્રી
(ગાંસકોળ, વડનગર)
મો. ૯૮૨૪૧ ૨૦૯૮૭



શ્રી બાબુભાઈ સોમાભાઈ પરમાર
ડિરેક્ટરશ્રી
(અર્જુનભારી, વડનગર)
મો. ૯૯૨૫૬ ૩૭૬૩૫



શ્રી ગિરીશકુમાર અમરતલાલ પટેલ
ડિરેક્ટરશ્રી
(નદીઓળ પડ, વડનગર)
મો. ૯૮૭૯૮ ૭૪૮૦૩



શ્રી વિનોદભાઈ મીઠાલાલ પટેલ
ડિરેક્ટરશ્રી
(ગાંસકોળ, વડનગર)
મો. ૯૯૭૪૯ ૧૨૯૪૫



શ્રી નિમેશકુમાર જુવણલાલ પટેલ
ડિરેક્ટરશ્રી
(જૂના ચાચરે, નદીઓળ, વડનગર)
મો. ૯૪૨૯૪ ૩૪૮૦૭



શ્રી મયંકકુમાર પ્રવિણભાઈ પટેલ
પ્રોફેશનલ ડિરેક્ટરશ્રી
(ચોયલ પેલેસ, વડનગર)
મો. ૯૪૨૮૪ ૧૦૯૯૩



શ્રી અશોકકુમાર બાબુલાલ મોદી
પ્રોફેશનલ ડિરેક્ટરશ્રી
(માતોર, સ્ટેશન રોડ, વડનગર)
મો. ૯૮૭૯૭ ૯૩૯૨૮



શ્રી હરેશભાઈ ડી. મોદી
ઈન. મેનેજરશ્રી
(ભાટીયા શેરી, વડનગર)
મો. ૯૦૧૬૪ ૧૫૮૯૪

વડનગર નાગરિક સહકારી બેન્ક લિ; વડનગર.

● નોટીસ ●

આથી બેન્કના તમામ સભાસદશ્રીઓને વિનંતી કરવામાં આવે છે કે, બેન્કની છાસઠમી (૬૬મી) વાર્ષિક સાધારણ સભા તા. ૨૮-૦૬-૨૦૨૬, રવિવારના રોજ સાંજે ૦૫-૦૦ કલાકે નીચેના કામોના નિકાલ કરવા મળશે તો સમયસર પધારવા વિનંતી છે.

સ્થળ : વડનગર લેઉવા પાટીદાર જ્ઞાતિની વાડી, અર્જુનભારી દરવાજા બહાર, વડનગર. તા. વડનગર.

● કામની વિગત ●

૧. ગઈ સાલનો સાધારણ સભાનો અહેવાલ (પ્રોસીડીંગ) વંચાણમાં લેવા બાબત.
૨. સને ૨૦૨૫-૨૬ ની સાલનું સરવૈયું તથા હિસાબો મંજૂર કરવા બાબત.
૩. બોર્ડ ઓફ ડીરેક્ટરની ભલામણો મુજબ સને ૨૦૨૫-૨૬ની સાલના નફાની વહેંચણી કરવા બાબત.
૪. સને ૨૦૨૬-૨૦૨૭ની સાલનું અંદાજ બજેટ મંજૂર કરવા બાબત.
૫. સને -૨૦૨૬-૨૦૨૭ ની સાલ માટે સ્ટેચ્યુટરી ઓડીટર્સની નિમણૂક કરવા તથા તેમનું મહેનતાણું નક્કી કરવા બાબત.
૬. ચુંટણીના નિયમો પ્રમાણે કરવામાં આવેલ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના ચુંટાયેલા સભ્યોના નામ જાહેર કરી મંજૂર કરવા બાબત.
૭. સને ૨૦૨૫-૨૦૨૬ ની સાલ માટે નક્કી કરેલ બજેટ કરતાં ખર્ચમાં થયેલ વધારાને બહાલી આપવા બાબત.
૮. પરિશિષ્ટ - અ મુજબ પેટા કાયદામાં સુધારા વધારા મંજૂર કરવા બાબત.

નોંધ :-

- (૧) હિસાબ તથા અન્ય માહિતી માટે સામાન્ય સભાના ત્રણ દિવસ અગાઉ બેન્કના સમય દરમિયાન લેખિત માગણી કરવી.
- (૨) વ્યક્તિ સભાસદ તથા પેઢી સભાસદે રીપોર્ટની નકલ સાથે રાખવા વિનંતી છે.
- (૩) કોરમના અભાવે મુલતવી રહેલી આ સભા તેજ કામકાજ કરવા માટે અડધા કલાક પછી તેજ સ્થળે મળશે. જેમાં કોરમનો બાધ રહેશે નહીં.

બોર્ડ ઓફ ડીરેક્ટર્સના હુકમથી,
હરેશ ડી. મોદી - ઈન્ચાર્જ મેનેજર

સ્ટેચ્યુટરી ઓડિટર	: અશ્વિન કે. યાજ્ઞીક એન્ડ કું - ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (મહેસાણા)
કોન્કરન્ટ ઓડિટર	: મનીષકુમાર બ્રહ્મભટ્ટ એન્ડ કું - ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (મહેસાણા)
ઓડીટ સલાહકાર	: વી.એસ. પટેલ એન્ડ એસોસીએટ્સ - ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (વિસનગર)
લીગલ એડવાઈઝર	: હામતખાન પઠાણ
ઈન્ચાર્જ મેનેજર	: હરેશ ડી. મોદી

● બેન્કર્સ ●

૧. ધી ગુજરાત સ્ટેટ કો.-ઓ. બેન્ક લિ. - અમદાવાદ.
૨. ધી મહેસાણા ડી. સેન્ટ્રલ કો.ઓ.બેન્ક લિ; - વડનગર.
૩. બેન્ક ઓફ બરોડા - વડનગર.
૪. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા - વડનગર.
૫. મહેસાણા અર્બન કો.ઓપ. બેન્ક - મહેસાણા. (હે.ઓ.)
૬. બેન્ક ઓફ ઈન્ડિયા - વડનગર.
૭. બેન્ક ઓફ મહારાષ્ટ્ર - વડનગર.
૮. પંજાબ નેશનલ બેન્ક - વડનગર.
૯. આઈડીએફસી ફ્રસ્ટ બેન્ક - ખેરાલુ.

વડનગર નાગરિક સહકારી બેન્ક લિ; વડનગર.

● સને ૨૦૨૫-૨૦૨૬ ●

● ૬૬ મો (છાસઠમો) વાર્ષિક અહેવાલ ●

માનનીય સભાસદ ભાઈઓ અને બહેનો,

આપ સૌના સાથ સહકાર અને પ્રેરણાઓના અડગ વિશ્વાસથી આપણી બેન્ક છાસઠ વર્ષ પુરા કરી ૬૭ (છડસઠ) મા મંગલમય વર્ષમાં પ્રવેશ કરી ચુકી છે, ત્યારે બેન્કની ૬૬ મી વાર્ષિક સાધારણ સભામાં આપ સર્વેને આવકારૂં છું.

તેમજ બેંકના બોર્ડ ઓફ ડીરેક્ટર્સ વતી આપણી બેંકની ૬૬ (છાસઠમી) વાર્ષિક સાધારણ સભા પ્રસંગે સને ૨૦૨૫-૨૦૨૬ ના (તા. ૩૧-૩-૨૦૨૬) ના પુરા થયેલા વર્ષનો વાર્ષિક અહેવાલ તથા ઓડિટ થયેલ સરવૈયું તેમજ નફા નુકશાનના હિસાબો આપ સૌની સમક્ષ રજૂ કરતા આનંદ અનુભવું છું.

સને ૨૦૨૫-૨૬ ના વર્ષ દરમ્યાન આપણી બેંકની કુલ આવક રૂા. ૩,૩૯,૩૯,૮૩૬-૦૭ પૈસાની થઈ છે. તેમાંથી પેટા કાયદાની કલમ ૪૨ પ્રમાણે રૂા. ૩,૦૩,૪૩,૦૦૯-૭૪ પૈસાની રકમો ખર્ચ અને જોગવાઈઓ માટે બાદ કરતાં વર્ષ આખરે રૂા. ૩૫,૯૬,૮૨૬-૩૩ પૈસા નો નફો રહેલ છે જેની ફાળવણી નીચે મુજબ કરવા બેંકનું કાર્યવાહક મંડળ ભલામણ કરે છે.

● નફાની ફાળવણી ●

અ.નં.	વિગત	રૂા. પૈસા
(૧)	રીઝર્વ ફંડ ખાતે લઈ જવા ૨૫% પ્રમાણે રૂા.	૮,૯૯,૨૦૬-૫૮
(૨)	ભરપાઈ થયેલ શેર પર ૮% લેખે ડીવીડન્ડ રૂા.	૧૦,૮૮,૦૦૮-૦૦
(૩)	બીડીડીઆર ૧૫% લેખે રૂા.	૫,૩૯,૫૨૩-૮૫
(૪)	શિક્ષણ ફાળો ૧% મુજબ રૂા.	૩૫,૯૬૮-૨૬
	ટોટલ...	૨૫,૬૨,૭૦૬-૭૯
	ની રકમ ચોખ્ખા નફામાંથી બાદ કરતાં રૂા. ૧૦૩૪૧૧૯-૫૪ ની ફાળવણી નીચે મુજબ કરવામાં આવે છે.	
(૫)	બિલ્ડીંગ ફંડ ૨૦% પ્રમાણે	૨,૦૬,૮૨૩-૮૧
(૬)	સાયબર / આઈટી ફંડ ૧૦% પ્રમાણે	૧,૦૩,૪૧૧-૮૫
(૭)	સભાસદ કલ્યાણ નિધી ફંડ ૨૦% પ્રમાણે	૨,૦૬,૮૨૩-૮૧
(૮)	તફાવતની રકમ ઈન્વેસ્ટમેન્ટ ફલ્ક્યુએશન ફંડ ખાતે	૫,૧૭,૦૫૯-૭૭
	ટોટલ...	૩૫,૯૬,૮૨૬-૩૩

સભાસદ સંખ્યા અને શેર ભંડોળ :-

તા. ૩૧-૩-૨૦૨૬ ના વર્ષ દરમ્યાન નવા સભાસદો ૨૩૧ દાખલ થતાં તેમજ ૧૮૧ સભાસદો છૂટા થતાં કુલ સભાસદોની સંખ્યા ૭૩૪૯ થવા પામેલ છે. તેમજ ભરપાઈ થયેલ શેર ભંડોળ રૂા. ૧૩૯૭૨૭૫૦-૦૦ થયેલ છે. રીઝર્વ બેંકના કેટલાક નિયમોનું પાલન આપણી બેંકે કરેલ છે. અને તમોએ શેર ભંડોળમાં વધારો કરવા જે સાથસહકાર આપ્યો છે તે બદલ આભાર માનીએ છીએ.

શ્રદ્ધાંજલિ :-

આપણી બેંકના પ્રોફેશનલ ડીરેક્ટરશ્રી સુરેશભાઈ નરોત્તમદાસ મોદી તા. ૨૧-૦૬-૨૦૨૫ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેઓએ આ બેંકમાં ડીરેક્ટર તરીકે સારી સેવા આપેલ હતી. જેઓ પ્રભુ શરણે થયેલ છે. પરમ કૃપાળું પરમાત્મા તેમના આત્માને શાંતિ આપે તથા કુટુંબી જનો પર આવી પડેલ આપત્તી સહન કરવાની પ્રભુ શક્તિ અર્પે તેવી પ્રાર્થના.....

રીઝર્વ ફંડ અને અન્ય ફંડો :-

સને ૨૦૨૫-૨૦૨૬ના વર્ષ દરમિયાન રિઝર્વ ફંડ તથા અન્ય ફંડોમાં વર્ષ આખરે રૂા. ૬,૪૧,૬૮,૩૩૫-૮૭ પૈસા થવા પામેલ છે.

થાપણો :-

બેંકના વિકાસમાં થાપણોનો ફાળો અગત્યનું અંગ છે, છેલ્લા કેટલાક સમયથી કો.ઓ. બેંકોનું માળખું લોક માનસમાં અવિશ્વાસનીય બનતું ગયું છે. સ્પર્ધાત્મક વાતાવરણ હોવા છતાં આપણી બેંક અતુટ વિશ્વાસથી ચાલી રહેલ છે. જેનો યશ સર્વ સભાસદો થાપણદારો અને ખાતેદારોને આભારી છે વર્ષ આખરે કુલ થાપણો રૂા. ૩૩,૫૮,૨૭,૩૬૫-૩૬ પૈસા જમા રહેલ છે. આપણી બેંકમાં જમા મુકેલી થાપણો એક ખાતામાં રૂા. ૫ લાખ સુધી ડીપોઝીટ ઈન્સ્યોરન્સ એન્ડ કેડીટ ગેરન્ટી કોર્પોરેશન ના નિયમ મુજબ વીમા યોજના નીચે સુરક્ષિત છે. ડીપોઝીટ ઈન્સ્યોરન્સ એન્ડ કેડીટ ગેરન્ટી કોર્પોરેશનને ચૂકવવાની થતી વીમા પ્રીમીયમની રકમ સમયસર ભરવામાં આવેલ છે.

ધિરાણ :-

બેંકના સભાસદોને રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના આદેશોની મર્યાદામાં રહી ધિરાણ લેનાર ગ્રાહકો સભાસદોની માગણી ધ્યાનમાં રાખી ધિરાણ માગણી સંતોષવા પ્રયત્નશીલ રહ્યા છીએ અને વર્ષ દરમિયાન બેંકે જુદાજુદા પ્રકારના કુલ ધિરાણો તા. ૩૧-૩-૨૦૨૬ ના રોજ રૂા. ૧૮,૮૪,૬૭,૦૭૫-૧૫ નું આપેલ છે.

મુદત વીતી (ઓવરડ્યુ) ધિરાણ બાકી :-

ધિરાણ ગમે તેટલા પ્રમાણમાં વધે પરંતુ મુદત વીતી બાકીનું પ્રમાણ તો ઓછામાં ઓછું હોવું જોઈએ. આ બાબતે બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યશ્રીઓ સતત ચિંતીત અને સક્રિય રહ્યા છે અને વસુલાતના કામને ટોચની અગ્રતા આપીને રોજબરોજ તે માટે બાકીદાર ઈસમોને રૂબરૂ સંપર્ક સાધી બોલાવીને બેંકે જુબેશના સ્વરૂપમાં સતત સઘન પ્રયાસો કર્યા છે.

અહેવાલના વર્ષ દરમિયાન મુદત વીતી બાકી ધિરાણ ૪.૧૫ ટકા થયું છે. આ ધિરાણની વસુલાત માટે બેંકના પ્રયાસો સતત ચાલુ છે. કેટલાક ધિરાણો સમયસર રીન્યુઅલ નહીં થવાથી કે નિયમિત હપ્તાઓ જમા નહીં થવાથી મુદત વીતી બાકી થયેલ છે. આવા બાકીદારો તથા જામીનદારોએ આ બાબતને ગંભીર ગણી લઈને તથા મુદત વીતી બાકીનું પ્રમાણ બેંકની પ્રગતિમાં અવરોધરૂપ ન બની રહે તે માટે હંમેશાં અપીલ કરેલ છે. આ માટે સભાસદો અને તેઓના જામીનદારો કે જેઓ જે ખાતેદાર સભાસદના જામીન છે. તેઓને સતત દબાણ કરી ધિરાણની વસુલાતમાં સાથ સહકાર આપે અને આ અંગે જરૂરી જાગૃતિ દાખવે તેવી વિનંતી છે.

ડીફ :-

જે થાપણદારો એ છેલ્લા ૧૦ વર્ષથી કોઈ લેવડ-દેવડ કરેલ ન હોય તેવા ખાતાઓની રકમ આરબીઆઈના નિયમ મુજબ નીચે જણાવ્યા પ્રમાણે ની રકમ ડીફ ખાતે જમા કરાવેલ છે.

૨૦૨૪-૨૫ ની રકમ	૨૮૩૪૭૧૮-૦૦
૨૦૨૫-૨૬ માં ભરેલ રકમ	૩૨૬૫૭૮-૦૦
ટોટલ	૩૧૬૧૨૯૭-૦૦
૨૦૨૫-૨૬ ડીફ કલેમની પરત આપ્યા	૨૫૬૭૪-૦૦
કુલ ટોટલ	૩૧૩૫૬૨૩-૦૦

બોર્ડ ઓફ ડિરેક્ટર્સશ્રીની ચુંટણી : બેંકના નવા નિયમ અને પેટા કાયદા મુજબ બેંકના તમામ ડિરેક્ટર્સશ્રીઓ એ પોતનો હોદ્દો છોડેલ અને ૨૦૨૬ થી ૨૦૩૧ ની ચુંટણીમાં અગીયાર (૧૧) જગ્યાઓ માટે ઉમેદવારી પત્રો મંગાવતા ૧૪ ઉમેદવારોના ફોર્મ પૈકી એક ઉમેદવારનું ફોર્મ ના મંજૂર થયેલ તે પૈકી ૨ (બે) ઉમેદવારો એ પોતાના ઉમેદવારી પત્રો પાછા ખેંચી લેવાથી (૧) શ્રીમતી સરલાબેન દલસુખભાઈ પટેલ (૨) શ્રી પોપટલાલ લક્ષ્મણદાસ મોદી (૩) શ્રીમતી મંજુલાબેન ગોવિંદલાલ પટેલ (૪) શ્રી શંકરલાલ ઝીણાભાઈ પટેલ (૫) શ્રી વિનોદચંદ્ર બુધાલાલ પટેલ (૬) શ્રી દિલીપકુમાર અરૂણભાઈ જયસ્વાલ (૭) શ્રી બીપીનચંદ્ર છોટાલાલ મોદી (૮) શ્રીમતી દીપીકાબેન દિનેશકુમાર પટેલ (૯) શ્રીમતી મીનાબેન છનાલાલ પટેલ (૧૦) શ્રી નિમેષકુમાર જીવણલાલ પટેલ (૧૧) શ્રી બાબુભાઈ સોમાભાઈ પરમાર ને ડિરેક્ટર્સશ્રી તરીકે બિન હરીફ જાહેર કરવામાં આવે છે.

પ્રોફેશનલ ડાયરેક્ટર : તરીકે આર.બી.આઈની ગાર્ડ ઓફ ઇન્સ પ્રમાણે (૧) અશોકકુમાર બાબુલાલ મોદી (૨) શ્રી મયંકકુમાર પ્રવિણચંદ્ર પટેલની નિમણૂક કરવામાં આવેલ છે.

વિશેષ :-

(૧) આપણી બેંક ડીપોઝીટ ઈન્સ્યોરન્સ સ્કીમ હેઠળ વીમો ઉતરાવી તેનું છેલ્લું વીમા પ્રીમીયમ જી.એસ.ટી. સાથે

રૂા. ૧૫૮૬૬૩-૦૫ તા. ૦૫-૦૫-૨૦૨૬ના રોજ ભરી દીધેલ છે જેથી રૂા. ૫,૦૦,૦૦૦-૦૦ (પાંચ લાખ) સુધીની ડીપોઝીટ આ સ્કીમ હેઠળ વીમાથી સુરક્ષિત છે.

- (૨) ખાતેદારનો વિકાસ રથ અટકે નહીં અને એની સમૃદ્ધ થવાની મનોકામના બુઝાઈ જાય નહીં તેની આ બેન્ક અહર્નિશ બેવના રાખે છે.

આપણી બેન્કે ભરતીના ઉછળતા મોજા જોયા છે. અને પાછલા વર્ષોમાં સહકારી બેન્કીંગ ક્ષેત્રે આવેલા ઝંઝાવાતો પણ પાર કરેલા છે. વિવિધ અગ્નિ પરીક્ષાઓમાંથી પસાર થયા બાદ આજે આપણે વિશ્વનીયતાના પર્યાય સુધી પહોંચ્યા છીએ જે સમયે સમગ્ર રાજ્યમાં સહકારી બેન્કીંગ પર આશંકાના વાદળો ઘેરાયેલા હતા ત્યારે પણ સર્વોત્તમ કાર્ય પધ્ધતિની આધારશીલા પર ઉભા રહી આપણી બેન્કે પોતાની અવિરત આગેફૂલ જાળવી રાખી છે. જે આપણા સહુના આત્મ વિશ્વાસને વધારે દઢ કરે છે.

- (૩) બેંકના ડીરેક્ટર્સ બોર્ડના સભ્યોનું ધિરાણ એફડીઓડી (ફીક્સ) સામે તા. ૩૧-૩-૨૬ના રોજ કુલ ધિરાણ રૂા. ૦૦-૦૦ લાખ આપેલ છે જે કુલ ધિરાણના ૦૦-૦૦ % આપેલ છે.

-: આભાર દર્શન :-

બેન્કના વાર્ષિક અહેવાલમાં બેન્કની પ્રગતીના આંકડા રજૂ કરતા જેટલો આનંદ થાય તેટલો જ આનંદ અને ગૌરવ સાથે અમો આભારની લાગણી પણ વ્યક્ત કરીએ છીએ. બેન્કના સંચાલનમાં બેન્કના અમારા સાથી ડીરેક્ટરશ્રીઓનો કરકસરયુક્ત વહીવટ અને સેવાભાવ તથા પોઝીટીવ વિચાર સરણીના કારણે બેન્કની પ્રગતિ ઝડપી થઈ શકી છે. ડીરેક્ટરશ્રીઓએ કિંમતી સમય આપી બેન્કના વિકાસમાં સહકાર આપવા બદલ તમામ સભાસદો વતી અમારા સાથી મિત્રોને અત્રે અંતઃકરણ પૂર્વક આભાર માનીએ છીએ.

બેન્કના ઝડપી વિકાસમાં કર્મચારીગણે બજાવેલ ફરજને પણ આભારની લાગણી સાથે નોંધ લેવામાં આવે છે.

બેન્કના કામકાજમાં રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા મે.રજીસ્ટર સાહેબશ્રી સહકારી મંડળીઓ ગાંધીનગર, ધી મહેસાણા ડી.કો.ઓ. બેન્ક લી; ના પ્રમુખશ્રી તથા સંચાલક મંડળનો તેમજ તેમની વડનગર બ્રાન્ચના એજન્ટશ્રીનો ધી ગુજરાત સ્ટેટ કો.ઓ. બેન્ક લી; અમદાવાદ, ગુજરાત અર્બન બેંક્સ ફેડરેશન, ઉત્તર ગુજરાત અર્બન કો.ઓ.પ. બેંક્સ ફેડરેશન, મહેસાણા, નેશનલ અર્બન કો-ઓ. બેંક્સ ફેડરેશન મે. જીલ્લા રજીસ્ટ્રારશ્રી સહકારી મંડળીઓ મહેસાણા તથા સહકારી ખાતાના અધિકારીઓ તેમજ અન્ય સહકારી કાર્યકરો તથા કોન્કરન્ટ ઓડીટરશ્રી અને વૈધાનીક (સ્ટ્રેચ્યુટરી) ઓડીટર્સ તરફથી બેન્કને પોતાની બેન્ક ગણી સલાહ સુચનો અને માર્ગદર્શન આપી બેન્ક પ્રત્યે શુભ લાગણી વ્યક્ત કરેલ છે. તે બદલ સૌનો અંતઃપૂર્વક આભાર માનીએ છીએ.

બેન્કની પ્રગતિમાં સાથ આપનાર અને પોતાના ધંધાનો ભોગ આપીને બેન્કની બોર્ડ ઓફ ડીરેક્ટરની મિટીંગોમાં વખતો વખત હાજરી આપનાર અને તેમજ ઉમદા સાથ સહકાર આપી બેન્કના વિકાસ કાર્યોને સફળ બનાવવા બદલ અમારા સાથી ડીરેક્ટર મિત્રોનો હૃદય પૂર્વક આભાર માનીએ છીએ.

આ બેન્કના વિકાસમાં પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે જેઓએ સહકાર આપેલો છે તે સર્વના અત્રે આભારી છીએ. બેન્કની પ્રગતિ માટે મહત્વના અંગરૂપ સર્વે થાપણદારો, સભાસદશ્રીઓ, શુભેચ્છકો અને ગ્રાહકોનો અમો હૃદય પૂર્વક આભાર માનીએ છીએ.

આપણી બેન્ક આપ સૌનો વધુને વધુ સહકાર મેળવી ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી અભ્યર્થના, સૌનો ફરી આભાર માનીએ છીએ. અને આપણી બેન્કના ઝડપી વિકાસ માટે વ્યક્તિ વિરોધ બાજુએ રાખી બેન્કના વિકાસ તરફ ધ્યાન દોરીએ અને xસમર્પણ સિવાય સિદ્ધિ નથીx સુત્રને સાકાર કરીને બેન્કના વિકાસમાં ફાળો આપીએ.

જય હિન્દ

ધન્યવાદ

જય સહકાર

સરલાબેન દલસુખભાઈ પટેલ

દિનેશકુમાર રમણલાલ પટેલ

ચેરમેન

વાઈસ ચેરમેન

★ ચુકવેલ વ્યાજની વિગત ★

૩૧-૩-૨૦૨૫	વિગત	૩૧-૩-૨૦૨૬
૯૬૭૫૩૯૧-૦૧	ઈન્ટેપેઈડ ઓન ડીપોઝીટ	૧૪૧૧૪૮૬૫-૨૦
૨૭૬૬૨૯૮-૦૦	ઈન્ટેપેઈડ ઓન સેવિંગ્સ	૨૫૬૭૧૮૯-૦૦
૭૭૦૬૫૮-૦૦	ઈન્ટેપેઈડ ઓન મીની ડીપોઝીટ	૬૬૫૯૬૮-૦૦
૧૫૦૪૩-૦૦	ઈન્ટેપેઈડ ઓન બોરોઈંગ	૨૨૨૦૩-૦૦
૧૩૫૭૬૨-૦૦	ઈન્ટેપેઈડ ઓન સેફ ડીપોઝીટ લોકર	૧૮૩૯૮૧-૦૦
૧૩૩૬૩૧૫૨-૦૧	ટોટલ	૧૭૫૫૪૨૦૬-૨૦

વડનગર નાગરિક સહકારી બેન્ક લિ; વડનગર.

Independent Auditor's Report

To,
The Members,
Vadnagar Nagrik Sahakari Bank Ltd.,
Vadnagar, Ta. Vadnagar, Dist. Mehsana.

Report on the Financial Statements

We have audited the accompanying financial statements of Vadnagar Nagrik Sahakari Bank Ltd as at **31st March 2026**, which comprise the Balance Sheet as at **31st March 2026**, the Profit and Loss Account, for the year then ended and a summary of significant accounting policies and other explanatory information.

Management's Responsibility for the Financial Statements

1. Management is responsible for the preparation of these financial statements that give a true and fair view of the financial position, financial performance, and cash flows of the Banking accordance with provisions of the Banking Regulations Act, 1949. The guidelines issued by the Reserve Bank of India and accounting principles generally accepted in India so far as applicable to Banks. This responsibility includes the design, implementation, and maintenance of internal controls relevant to the preparation and presentation of the financial statements that are free from material misstatement, whether due to fraud or error.

Auditor's Responsibility

Our responsibility is to express an opinion on these financial statements based on our audit. We conducted our audit in accordance with Standards on Auditing issued by The Institute of Chartered Accountants of India. Those Standards require that we comply with ethical requirements and plan and perform the audit to obtain reasonable assurance about whether the

વડનગર નાગરિક સહકારી બેન્ક લિ; વડનગર.

financial statements are free from material misstatements.

3. An audit involves performing procedures to obtain audit evidence about the amounts and disclosures in the financial statements. The procedures selected depend on the auditor's judgment, including the assessment of the risks of material misstatement of the financial statements, whether due to fraud or error. In making those risk assessments, the auditor considers internal control relevant to the Bank's preparation and fair presentation of the financial statements in order to design audit procedures that are appropriate in the circumstances, but not for the purpose of expressing an opinion on effectiveness of the Bank's internal control. An audit also includes evaluating the appropriateness of accounting policies used and the reasonableness of the accounting estimates made by management, as well as evaluating the overall presentation of the financial statements.
4. We believe that the audit evidence we have obtained is sufficient and appropriate to provide a basis for our audit opinion.

Opinion

5. In our opinion and to the best of our information and according to the explanations given to us, the aforesaid financial statements together with the notes here on give the information required by The Banking Regulation Act, 1949 and guidelines issued by Reserve Bank of India and the Central Registrar of Cooperative Societies in the manner so required and give a true and fair view in conformity with the accounting principles generally accepted in India.
 - a. In case of the Balance Sheet, of state of affairs of the Bank as on **31st March 2026**.
 - b. In case of the Profit and Loss Account, of the profit for the year ended on that date; and

Information other than financial statement and Audit report thereon,

વડનગર નાગરિક સહકારી બેન્ક લિ; વડનગર.

The Bank's Board of directors is responsible for the other information. The other information comprised the information included in the report of board of directors including explanatory information and explanation but does not include the financial statement and our auditor's report thereon.

In connection with our audit, we have read the other information as part of audited financial statement. Regarding the information, if any material misstatement is observed, we need to report thereon. We have nothing to report in this regard.

Report on Other Legal & Regulatory Requirements

6. The Balance Sheet and the Profit and Loss Account have been drawn up in Forms "A" and "B" respectively of the Third Schedule to the Banking Regulation Act, 1949.
7. Subject to the limitation of audit as indicated in paragraph 2 to 4 above, we report that:
 - a) We have obtained all the information and explanations, which to the best of our knowledge and belief were necessary for the purpose of our audit and have found to be satisfactory.
 - b) In our opinion, proper books of account required by law have been kept by the Bank so far as it appears from our examination of those books and proper returns adequate for the purposes of our audit have been received from the branches/offices.
 - c) The transactions of the Bank which came to our notice have been within the powers of the Bank.
 - d) The Balance Sheet and the Profit and Loss Account dealt with by this report, are in agreement with the books of account and the return.
 - e) The reports of concurrent auditors of the branches/ Head offices have

વડનગર નાગરિક સહકારી બેન્ક લિ; વડનગર.

been relied upon while framing our opinion of the bank.

- f) The accounting standards adopted by the Bank are consistent with those laid down by accounting principles generally accepted in India so far as applicable to Banks.
- g) In our opinion and according to information and explanations given to us, we have not noticed any material impropriety or irregularity in the expenditure or in the realization of money due to the bank.

For Ashvin K. Yagnik & Co.
Chartered Accountants
Firm Reg. No. 100710W

CA Hardik M Satvara
Partner
Membership No. 191213

RBI UNIQUE CODE NO : 783489

Place: Mehsana
Date : 28.05.2026

● પરિશિષ્ટ - અ મુજબ ●

ક્રમ	હાલનો પેટા નિયમ	સુધારા બાદ બનતો પેટા નિયમ	સુધારાનું કારણ
૧	આ બેંકનું કાર્યક્ષેત્ર મહેસાણા, પાટણ, ગાંધીનગર જિલ્લાની હદમાં આવેલ અર્બન (શહેરી) અને સેમી અર્બન (અર્ધ શહેરી) વિસ્તાર તથા તેનાથી ૧૦ કીમી ત્રિજ્યા સુધીના વિસ્તારનું રહેશે.	આ બેંકનું કાર્યક્ષેત્ર મહેસાણા, પાટણ, ગાંધીનગર જિલ્લા અને અમદાવાદ શહેર નું કાર્યક્ષેત્ર રહેશે. ઉપર જણાવેલ કાર્યક્ષેત્ર ના હદમાં કોઈપણ સુધારો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની પૂર્વ મંજૂરી લઈ તેમજ જિલ્લા રજીસ્ટારશ્રીની પરવાનગી લઈ કરી શકાશે.	બેન્કના વિકાસ માટે
૨	શેર ભંડોળ શેર વેચી કરેલ શેર ભંડોળ રૂા. ૧૫૦૦૦૦૦૦ અંકે રૂપિયા એક કરોડ પચાસ લાખ થી વધુ હોવું જોઈએ નહીં. અને દરેક શેરની પુરેપુરી રકમ એક સાથે વસુલાત લેવામાં આવશે.	શેર વેચી કરેલ શેર ભંડોળ રૂા. ૨૦૦૦૦૦૦૦ અંકે રૂપિયા બે કરોડ થી વધુ હોવું જોઈએ નહીં. અને દરેક શેરની પુરેપુરી રકમ એક સાથે વસુલાત લેવામાં આવશે.	શેર ભંડોળ મર્યાદા વધારવા ની હોવાથી આ સુધારો બેંકના વિકાસ માટે જરૂરી છે વહીવટી સુગમતા માટે
૩	બેંકના બોર્ડ ઓફ ડીરેક્ટર્સ	બેંકના કુલ ડીરેક્ટશ્રીઓના ૫૧% ડીરેક્ટરો શિક્ષિત હોવા જરૂરી છે.	હાલના કાયદા મુજબ સુધારો

વડનગર નાગરિક સહકારી બેન્ક લિ; વડનગર.

● થાપણ વ્યાજદર ●

વ્યાજ દર

બચત ખાતું : ૨.૮૦% વ્યાજ અને કોઈપણ જાતની અગાઉથી ખબર આપ્યા સિવાય ખાતામાંથી જોઈએ તેટલી રકમ ખાતાના નિયમ પ્રમાણે નાણાં ઉપાડવાની વ્યવસ્થા. ચેકથી પણ નાણાં ઉપાડી શકાય છે. સેવિંગ્સ ખાતામાં રોજરોજનું વ્યાજ આપવામાં આવશે.

રીકરીંગ ડીપો. એકાઉન્ટ

રીકરીંગ ડીપોઝીટ યોજનામાં આકર્ષક વ્યાજ આપવામાં આવે છે.

★ કરન્ટ/સેવિંગ્સ ખાતેદારોએ બેંક ખાતા સીકેવાયસી ન કરાવેલ હોય તે કરાવવું ફરજિયાત છે. (પાનકાર્ડ તથા ફોટો સાથે લાવવો)

જે થાપણદારોએ બેંકમાં આધાર કાર્ડ આપેલ ન હોય એ થાપણ દારોએ પિતાનું નામ - માતાનું નામ મોબાઈલ નંબર સાથે સહી કરી બેંકમાં આપવાનું રહેશે.

જે ડીપોઝીટરો અને શેર હોલ્ડરોએ વારસાઈ ન કરવી હોય તો બેંક આવી કરાવી જવા વિનંતી.

બાંધી મુદત થાપણ :

૧. ૦૭ દિવસ થી ૮૯ દિવસ માટે	૨.૮૦ %
૨ ૮૦ દિવસ થી ૧૭૯ દિવસ માટે	૪.૦૦ %
૩ ૧૮૦ દિવસ થી ૩૬૪ દિવસ માટે	૫.૦૦ %
૪ ૩૬૫ દિવસ ઉપર	૬.૫૦ %

સીનીયર સીટીઝનને ૦૧% વધુ વ્યાજ આપવામાં આવે છે.

● કેશ સર્ટીફિકેટ ડીપોઝીટ યોજના ●

● મુદત પુરી થયે મળતી રકમ ●				
રોકાણ રૂા.	૨૪ માસ	૩૬ માસ		
૧૦૦૦/-	૧૧૩૮/-	૧૨૧૩/-		
ટકા	૬.૫૦%	૬.૫૦%		

કેશ સર્ટીફિકેટ ડીપોઝીટ યોજના રૂા. ૧૦૦૦ ના ૧૨૯ માસે રૂા. ૨૦૦૦/-

● સીનીયર સીટીઝન માટે કેશ સર્ટીફિકેટ ડીપોઝીટ યોજના ●

● મુદત પુરી થયે મળતી રકમ ●				
રોકાણ રૂા.	૨૪ માસ	૩૬ માસ		
૧૦૦૦/-	૧૧૪૮/-	૧૨૩૧/-		
ટકા	૭.૦૦%	૭.૦૦%		

સીનીયર સીટીઝન માટે કેશ સર્ટીફિકેટ ડીપોઝીટ યોજના રૂા. ૧૦૦૦ ના ૧૨૦ માસે રૂા. ૨૦૦૨

● રીકરીંગ ડીપોઝીટ યોજના ●

હમ્મની રકમ	૧૨ માસ	૨૪ માસ	૩૬ માસ	૪૮ માસ	૬૦ માસ
૫૦	૬૨૧	૧૨૮૪	૧૮૮૧	૨૭૪૫	૩૫૫૦
૧૦૦	૧૨૪૩	૨૫૬૮	૩૮૮૩	૫૪૮૧	૭૦૮૮
૨૦૦	૨૪૮૬	૫૧૩૭	૭૮૬૫	૧૦૮૮૧	૧૪૧૮૮
વ્યાજનો દર	૬.૫૦%	૬.૫૦%	૬.૫૦%	૬.૫૦%	૬.૫૦%

● ધીરાણ વ્યાજ દરો ●

સિક્યોર્ડ ધીરાણ

૧૧.૦૦

અનસિક્યોર્ડ

૧૧.૫૦

FDDOD સિક્યુરીટી રસીદ વ્યાજ કરતા

૧ % વધુ

વડનગર નાગરિક સહકારી બેન્ક લિ; વડનગર.

● તા. ૩૧-૩-૨૦૨૬ ના રોજનું સરવેયું ●

તા. ૩૧-૩-૨૦૨૫		ભંડોળ તથા દેવું	તા. ૩૧-૩-૨૦૨૬	
રૂા.	પૈસા		રૂા.	પૈસા
૧૫૦૦૦૦૦૦-૦૦		૧ શેર ભંડોળ		૧૫૦૦૦૦૦૦-૦૦
		અધિકૃત શેર ભંડોળ ૬૦૦૦૦૦ દરેક શેર		
૧૨૬૩૩૩૫૦-૦૦		રૂા. ૨૫/- નો ગઈ સાલ ૬૦૦૦૦૦ નો દરે ૨૫નો		૧૩૯૭૨૭૫૦-૦૦
		(બ) બહાર પાડેલ શેર ભંડોળ ૫૫૮૮૧૦		
		શેરદરેક રૂા. ૨૫/- નો ગઈ સાલ ૫૦૫૩૩૪		
૧૨૬૩૩૩૫૦-૦૦		(ક) વસુલ આવેલ શેર ભંડોળ જે પૈકી		
		૫૫૮૮૧૦/- શેર દરેક રૂા. ૨૫/- નો	૧૩૯૭૨૭૫૦-૦૦	
		(ગઈ સાલ ૫૦૫૩૩૪/- શેર)	---	૧૩૯૭૨૭૫૦-૦૦
		(અ) વ્યક્તિઓ		
		(બ) સરકારી સંસ્થાઓ		
		(ક) રાજ્ય સરકાર		
૧૭૯૪૫૩૧૦-૦૫		૨ રીઝર્વ ફંડ અને બીજા ફંડો		
૩૧૦૬૯૧૦-૮૮		સ્ટેચ્યુટરી રીઝર્વ ફંડ	૧૯૮૧૨૫૯૧-૯૭	
૩૫૦૨૫-૬૭		બીલ્ડીંગ ફંડ	૩૬૩૪૮૬૨-૭૬	
૩૫૪૩૨૭-૨૭		ધર્માદા ફંડ	૩૫૦૨૫-૬૭	
૫૯૦૦૦૦-૦૦		સ્ટાફ ગ્રેજ્યુઈટીફંડ	૩૬૯૩૬૮-૦૩	
---		સ્ટાન્ડર્ડ એસેટ્સ પ્રોવિઝન	૫૯૦૦૦૦-૦૦	
૨૮૬૫૬૫૨-૦૦		ઈન્વેસ્ટમેન્ટ ડેપ્રીએશન રીઝર્વ	૧૩૩૬૭૫૦-૦૦	
૧૪૦૦૪૫૪૬-૫૮		અમદાવાદ અર્બન બેંક રીઝર્વ	૨૮૬૫૬૫૨-૦૦	
૧૩૩૫૫૨૭-૮૧		ખોટા અને શકમંદ લેણાં રીઝર્વ એન.પી.એ.	૧૪૦૦૪૫૪૬-૫૮	
૧૫૦૦૦૦-૦૦		રીવેલ્યુએશન રીઝર્વ	૧૩૦૨૧૪૦-૦૩	
૨૯૭૩૩૫૨-૫૦		મહેસાણા ડિસ્ટ્રીક્ટ બેંક શેર પ્રોવિઝન	૧૫૦૦૦૦-૦૦	
૧૧૯૧૭૩૨૮-૪૪		ઈન્વેસ્ટમેન્ટ ફલ્યુએશન રીઝર્વ	૪૮૨૧૧૮૪-૦૮	
૫૦૦૦૦૦-૦૦		બેંક ઓફ ઈન્ડિયા ફોડ પ્રોવિઝન	૧૧૯૧૭૩૨૮-૪૪	
૩૨૬૩૫૮-૭૦		શેર હોલ્ડર ગીફ્ટ આર્ટીકલ પ્રોવિઝન	---	
૮૦૦૦૦૦-૦૦		સાયબર / આઈટી ફંડ	૫૯૦૩૩૪-૬૪	
૯૩૯૮૪૧-૩૨		કોમ્પ્યુટર એન્ડ ટેકનોલોજી	૮૦૦૦૦૦-૦૦	
---		સ્પે. ખોટા અને શકમંદ લેણાં	૧૮૭૬૧૩૨-૨૭	
		એજ્યુકેશન ફંડ	૬૨૪૧૯-૪૦	૬૪૧૬૮૩૩૫-૮૭
૨૧૬૨૬૩૨૯૪-૦૦		૩. મુખ્ય ગોણ રાજ્ય ભાગીદારી નિધિ :		
		૪. થાપણો	૨૩૩૭૮૨૧૯૫-૦૦	
		(૧) બાંધી મુદતની થાપણો		
		(અ) વ્યક્તિઓ		
		(બ) મધ્યસ્થ સહકારી બેન્ક		
		(ક) મંડળીઓ		
૨૮૬૭૪૦૮૨૫-૨૨		આગળ ખેંચ્યા.....	૨૩૩૭૮૨૧૯૫-૦૦	૭૮૧૪૧૦૮૫-૮૭

વડનગર નાગરિક સહકારી બેન્ક લિ; વડનગર.

● તા. ૩૧-૩-૨૦૨૬ ના રોજનું સરવેયું ●

તા. ૩૧-૩-૨૦૨૫		મિલ્કત તથા લેણું	તા. ૩૧-૩-૨૦૨૬	
રૂા. પૈસા			રૂા. પૈસા	રૂા. પૈસા
૧૩૯૩૮૧૨૨-૦૮	૧ રોકડ		૧૪૫૩૮૮૮૯-૭૦	૧૪૫૩૮૮૮૯-૭૦
	હાથ ઉપર, રીઝર્વ બેન્ક તથા સ્ટેટ બેન્ક			
	ઓફ ઈન્ડિયા તથા સ્ટેટ કો.ઓ. બેન્કમાં તથા			
	સેન્ટ્રલ કો.ઓ. બેન્કમાં			
૨૫૦૨૨૯૯-૫૧	૨ બીજી બેન્કમાં સિલક :		૩૯૨૭૪૭૨-૧૭	
૯૪૨૩૬-૫૪	ચાલુ ખાતામાં		---	
૪૨૩૬૯-૬૪	સેવિંગ્સ બેન્ક ખાતામાં		---	
૫૧૦૭-૭૬	સ્ટાફ પી.એફ. સેવિંગ્સ ખાતામાં		---	
૪૫૩૬૫૬૫૨-૦૦	સ્ટાફ ગ્રેજ્યુટી સેવિંગ્સ ખાતામાં		૪૨૩૪૯૩૮૩-૦૦	૪૬૨૭૬૮૫૫-૧૭
---	બાંધી મુદત એફડીઆરમાં		---	
	૩ કોલ અને ટુંકી મુદતના નાણાં :			
૧૪૯૪૧૧૦૦૦-૦૦	૪ રોકાણો :		૧૫૪૨૪૨૫૦૦-૦૦	
	મધ્યસ્થ અને રાજ્ય સહકારી			
	જામીનગીરીઓમાં ખરીદ કિંમત (G.O.I)			
	સહકારી સંસ્થાઓના શેરોમાં			
૧૫૫૦૦૦-૦૦	(૧) એમ.ડી.સી.શેર ૧૫૦૦૦૦-૦૦		૬૫૫૦૦૦-૦૦	૧૫૪૮૯૭૫૦૦-૦૦
	(૨) ગુજરાત સ્ટેટ બેન્ક શેર ૫૦૦૦-૦૦			
	(૩) NUCFDC ૨૫-૨૬ શેર ૫૦૦૦૦૦-૦૦			
	૫ મુખ્ય ગૌણ રાજ્ય ભાગીદારી નિધિ રોકાણો :			
	૬ ધીરાણ			
	ટુંકી મુદતની લોન કેશકડીટ ઓવરડ્રાફ્ટ			
	અને બીલ્સ ડિસ્કાઉન્ટ જે પૈકી અવેજવાળુ			
૧૧૬૧૮૯૩-૦૦	(અ) સરકારી અને બીજી માન્ય		૧૮૨૫૯૯૫-૦૦	
	જામીનગીરીઓ સામે			
	ગઈ સાલ રૂા. ચાલુસાલે રૂા.			
	૧૧૬૧૮૯૩-૦૦ ૧૮૨૫૯૯૫-૦૦			
૪૭૮૪૯૭૦૫-૨૬	(બ) બીજી ટેન્જબલ જામીનગીરીઓ સામે		૪૮૮૦૪૩૮૩-૭૦	
	ગઈ સાલ રૂા. ચાલુ સાલ રૂા.			
	૪૭૮૪૯૭૦૫-૨૬ ૪૮૮૦૪૩૮૩-૭૦			
૨૬૦૫૨૫૩૮૫-૭૯	આગળ ખેંચ્યા.....		૫૦૬૩૦૩૭૮-૭૦	૨૧૫૭૧૩૨૪૪-૮૭

વડનગર નાગરિક સહકારી બેન્ક લિ; વડનગર.

● તા. ૩૧-૩-૨૦૨૬ ના રોજનું સરવૈયું ●

તા. ૩૧-૩-૨૦૨૫		ભંડોળ તથા દેવું	તા. ૩૧-૩-૨૦૨૬	
રૂા.	પૈસા		રૂા.	પૈસા
૨૮૬૭૪૦૮૨૫-૨૨		પાછળનો સરવાળો...	૨૩૩૭૮૨૧૯૫-૦૦	૭૮૧૪૧૦૮૫-૮૭
૮૭૨૩૭૮૯૬-૧૧		સેવિંગ્સ બેન્ક થાપણો :-	૯૩૭૩૩૪૮૫-૮૬	
-----		(અ) વ્યક્તિઓ	-----	
-----		(બ) મધ્યસ્થ સહકારી બેન્કો	-----	
		(ક) બીજી મંડળીઓ	-----	
૮૮૭૧૨૩૯-૧૧		ચાલુ થાપણો	૮૩૧૧૬૮૪-૫૦	
-----		(અ) વ્યક્તિઓ	-----	
-----		(બ) મધ્યસ્થ સહકારી બેન્કો	-----	
		(ક) બીજી મંડળીઓ	-----	૩૩૫૮૨૭૩૬૫-૩૬
-----		કોલ અને ટુંકી મુદતની થાપણો :-		-----
		૫ કરજ		
		(અ) ટુંકી મુદતની લોન રોકડ શાખા		
		અને ઓવર ડ્રાફ્ટ પૈકી Fix O./D		
		૧. સરકારી અને અન્ય જામીનગીરીના		
		તારણ સામે		
		૨. અન્ય વાસ્તવીક જામીનગીરીના તારણ સામે		
		(બ) મધ્યમ મુદતની લોન		
		(ક) લાંબી મુદતની લોન		
		૧. સ્ટેટ બેંક ઈન્ડિયામાંથી		
		૨. રાજ્ય સરકાર તરફથી		
		૩. અન્ય રીતે મેળવેલ લોન		
		૬. બીલ્સ ફોર કલેક્શન :-		
		(સામી બાજુએ જણાવ્યા મુજબ)		
		૭. બ્રાન્ચોના એડજેસ્ટમેન્ટ		
૨૦૯૧૫૧૭-૪૬		૮. મુદત વિતેલ વ્યાજ અને રીઝર્વ + એનપીએ	૨૬૯૨૮૮૬-૪૬	
+ ૧૯૦૮૨૫૨-૩૪		ચાલુ વર્ષનું દાવાનું	+ ૧૭૦૨૧૦૦-૦૦	
કુલ ૩૯૯૯૭૬૯-૮૦			કુલ ૪૩૯૪૯૮૬-૪૬	૪૩૯૪૯૮૬-૪૬
૪૮૨૨૯૨૫-૫૬		૯. વ્યાજ આપવાનું બાકી		૭૨૫૩૦૬૫-૫૬
૩૯૧૬૭૨૬૫૫-૮૦		આગળ ખેંચ્યા		૪૨૫૬૧૬૫૦૩-૨૫

વડનગર નાગરિક સહકારી બેન્ક લિ; વડનગર.

● તા. ૩૧-૩-૨૦૨૬ ના રોજનું સરપૈયું ●

તા. ૩૧-૩-૨૦૨૫		મિલકત તથા લેણું		તા. ૩૧-૩-૨૦૨૬	
રૂા. પૈસા		રૂા. પૈસા		રૂા. પૈસા	
૨૬૦૫૨૫૩૮૫-૭૯	પાછળનો સરવાળો..... ઉપર ધિરાણ પૈકી વ્યક્તિઓ પાસે લેણું ગઈ સાલ ચાલુ સાલ ૪૯૦૧૧૫૯૮-૨૬ ૫૦૬૩૦૩૭૮-૭૦ ઉપરના ધિરાણ પૈકી મુદત વીતી બાકી ગઈ સાલ ચાલુ સાલ ૩૯૬૭૩૧૨-૫૯ ૩૧૦૨૮૯૯-૪૮ વસુલાત માટે ખોટા શકમંદ ગણાય તેવું લેણું ગઈ સાલ ચાલુ સાલ -----	૫૦૬૩૦૩૭૮-૭૦		૨૧૫૭૧૩૨૪૪-૮૭	
૬૮૮૬૭૩૮૪-૫૫	મધ્યમ મુદતની લોન જે પૈકી અવેજવાળુ (અ) સરકારી અને બીજી ટેન્જીબલ જામીનગીરીઓ સામે ગઈ સાલ ચાલુ સાલ રૂા. નથી રૂા. નથી (બ) બીજી ટેન્જીબલ જામીનગીરીઓ સામે ગઈ સાલ ચાલુ સાલ ૬૮૮૬૭૩૮૪-૫૫ ૯૬૧૮૯૬૦૮-૮૮ ઉપરના ધિરાણ પૈકી વ્યક્તિઓ પાસે લેણું ગઈ સાલ ચાલુ સાલ ૬૮૮૬૭૩૮૪-૫૫ ૯૬૧૮૯૬૦૮-૮૮ ઉપરના ધિરાણ પૈકી મુદત વીતી બાકી ગઈ સાલ ચાલુ સાલ ૨૪૭૭૫૯૩-૭૨ ૨૮૧૪૮૪૯-૬૨ વસુલાત માટે ખોટા શકમંદ ગણાય તેવું ગઈ સાલ ચાલુ સાલ રૂા. ૩૧૧૦૮૪૯-૧૮ રૂા. ૨૭૦૪૩૮૦-૧૮	૯૬૧૮૯૬૦૮-૮૮			
૪૫૫૪૭૦૫૯-૮૧	લાંબી મુદત લોનની જે પૈકી અવેજવાળુ (અ) સરકારી અને બીજી જામીનગીરીઓ સામે નથી ઉપર ધિરાણ પૈકી વ્યક્તિઓ પાસે લેણું ગઈ સાલ ચાલુ સાલ ૪૫૫૪૭૦૫૯-૮૧ ૪૨૬૪૭૦૮૭-૫૭	૪૨૬૪૭૦૮૭-૫૭			
૩૭૪૯૩૯૮૩૦-૧૫	આગળ ખેંચ્યા.....	૧૮૯૪૬૭૦૭૫-૧૫		૨૧૫૭૧૩૨૪૪-૮૭	

વડનગર નાગરિક સહકારી બેન્ક લિ; વડનગર.

● તા. ૩૧-૩-૨૦૨૬ ના રોજનું સરવૈયું ●

તા. ૩૧-૩-૨૦૨૫		ભંડોળ તથા દેવું	તા. ૩૧-૩-૨૦૨૬	
રૂા.	પૈસા		રૂા.	પૈસા
૩૯૧૬૭૨૬૫૫-૮૦		પાછળનો સરવાળો....		૪૨૫૬૧૬૫૦૩-૨૫
		૧૦ અન્ય જવાબદારીઓ :		
૧૭૦૦-૦૦		- શેર અરજી ખાતુ	-----	
૬૩૭૭૧૫-૦૦		- ચૂકવવા પાત્ર ડીવીડન્ડ (પરીશિષ્ટ ૧ મુજબ)	૪૪૯૬૧૬-૦૦	
૧૨૫૪૪-૦૦		- ચુંટણી અનામત	-----	
૨૫-૦૦		- નોમીનલ સભાસદ ફી	૨૫-૦૦	
૯૬૮૭૫-૦૦		- અનામત	૧૨૭૭૨૩-૪૬	
૫૧૦૭-૭૬		- સ્ટાફ ગ્રેજ્યુટી સ્કીમ ફંડ એમ.ડી.સી.	-----	
૪૨૩૬૯-૬૪		- સ્ટાફ પ્રો. ફંડ સેવિંગ્સ એમ.ડી.સી.	-----	
૪૬૮૩૯૫૪-૦૦		- ઈપીએફ રીઝર્વ (ઈપીએફ ગવર્મેન્ટ)	૫૩૬૨૫૧૪-૦૦	
૨૫૦૦૦૦-૦૦		- ઓડીટ ફી પ્રોવિઝન	૨૭૫૦૦૦-૦૦	
૨૭૫૪૫-૦૦		- બિલ પરચેઝ પેએબલ	-----	
૪૬૮૦૦-૦૦		- એડવોકેટ ફી પ્રોવિઝન	-----	
---		- ગ્રીફટ આર્ટીકલ સરપ્લસ ડીફંડ	૧૪૩૧૬૧-૦૦	૬૩૫૮૦૩૯-૪૬
૨૦૬૧૮૭૦-૦૦		- ઈન્કમેટેક્સ પ્રોવિઝન	૧૩૮૦૮૦૨-૦૦	૧૩૮૦૮૦૨-૦૦
		૧૧ નફા - લુકશાન :		
		પાછળ સરવૈયા મુજબ નફો		
૬૨૪૧૯૩૯-૬૭		બાદ : વહેંચણી		
(-) ૬૨૪૧૯૩૯-૬૭		બેલેન્સ		
૦૦૦૦૦૦૦૦-૦૦		ઉમેરો		
૬૨૪૧૯૩૯-૬૭		નફા નુકશાન ખાતેથી લાવ્યા તે	૩૫૯૬૮૨૬-૩૩	૩૫૯૬૮૨૬-૩૩
		૧૨ : આકસ્મિક જવાબદારીઓ :		
		૧. આપવામાં આવેલ ગેરંટી અંગેની		
		બાકી રહેતી જવાબદારીઓ		
		ગઈ સાલ રૂા. ચાલુ સાલે રૂા.		
		કુલ સરવાળો.....		
૪૦૫૭૮૧૧૦૦-૮૭		ઓફ બેલેન્સીટ આઈટમ (DEAF RBI)		૪૩૬૯૫૨૧૭૧-૦૪
૨૮૩૪૭૧૯-૦૦				૩૧૩૫૬૨૩-૦૦
વડનગર		અમારા આજ તારીખનો રીપોર્ટ અને સામાન્ય	હરેશ ડી. મોદી	
તા. ૨૮-૦૫-૨૦૨૬		શેરો ભાગ-૨ને આધીન - અશ્વિનકે યાજ્ઞિક એન્ડ કું - મહેસાણા. મેમ્બર નં. ૧૮૧૨૧૩	ઈન્યાર્જ મેનેજર	

વડનગર નાગરિક સહકારી બેન્ક લિ; વડનગર.

● તા. ૩૧-૩-૨૦૨૬ ના રોજનું સરવૈયું ●

તા. ૩૧-૩-૨૦૨૫		મિલ્કત તથા લેણું		તા. ૩૧-૩-૨૦૨૬	
રૂા.	પૈસા			રૂા.	પૈસા
૩૭૪૯૩૯૮૩૦-૧૫		પાછળનો સરવાળો....		૧૮૯૪૬૭૦૭૫-૧૫	૨૧૫૭૧૩૨૪૪-૮૭
		(બ) બીજી ડેન્જીબલ જામીનગીરીઓ સામે ઉપરના ધિરાણ પૈકી વ્યક્તિઓ પાસે લેણું રૂા. ઉપરના ધિરાણ પૈકી મુદત વીતી બાકી રૂા. વસુલાત ગઈ સાલ ચાલુ સાલ			૧૮૯૪૬૭૦૭૫-૧૫
		૧૭૭૩૩૪૦-૨૭	૧૮૪૬૮૮૨-૬૭		
		માટે ખોટા અને શકમંદ ગણાય તેવું લેણું રૂા. ગઈ સાલ ચાલુ સાલ			
		૭૩૭૮૦૨-૦૦	૭૩૭૮૦૨-૦૦		
૨૦૯૧૫૧૭-૪૬		બ. મળવા પાત્ર વ્યાજ :			૨૬૯૨૮૮૬-૪૬
૪૫૯૯૬૭૩-૩૦		-જે પૈકી મુદત વિતેલ			૪૨૦૦૩૨૯-૦૦
		-લેવાપાત્ર વ્યાજ (FD&GOI Secu)			-----
		પરિશિષ્ટ ૨ મુજબ			
	----	૮. બીલ રીસીએબલ :			
		સામી બાજુ જણાવ્યા મુજબ			
૧૩૯૧૦૯૬-૭૩		૯. ડ્રાન્ય એડજેસ્ટમેન્ટ :			
		૧૦ મકાનો :			
		બાદ ઘસારો	૧૩૯૧૦૯૬-૭૩		૧૩૫૬૩૧૯-૭૩
			- ૩૪૭૭૭-૦૦		
		૧૧ ફર્નિચર અને સરંજામ :	૧૩૫૬૩૧૯-૭૩		
			૧૧૮૦૨૬૩-૧૨		-----
૧૧૯૦૨૬૩-૧૨		બાદ ઘસારો	૧૨૧૩૪૦-૦૦		
			૧૦૬૮૮૨૩-૧૨		૧૦૯૪૫૨૩-૧૨
			+ ૨૫૬૦૦-૦૦		
			૧૦૮૪૫૨૩-૧૨		
૩૯૩૯૩-૩૭		૧૨ કોમ્પ્યુટર :	૩૯૩૯૩-૩૭		
		બાદ ઘસારો	- ૧૮૭૦૦-૦૦		
		+નવી ખરીદી	+ ૫૭૧૦૦-૦૦		૭૬૭૯૩-૩૭
			૭૬૭૯૩-૩૭		
૧૨૫૯૦-૦૦		૧૩ બીજી મિલ્કત			
૯૯૦૦૦-૦૦		સ્પે. રીકવરી ઓફીસર અનામત એકા.		-----	
૨૬૪૦૦-૦૦		સ્ટેશનરી	૧૦૦૦૦૦-૦૦		
૪૬૮૩૯૫૪-૦૦		અધેશીવ સ્ટેમ્પ	૨૨૨૦૦-૦૦		
૧૨૭૪૦-૦૦		ઈપીએફ ઓફીસ ગવર્નમેન્ટ	૫૩૬૨૫૧૪-૦૦		
૪૦૮૪૪-૦૦		જી.ઈ.બી. સીક્યુરીટી ડીપોઝીટ	૧૨૭૪૦-૦૦		
૧૫૦૦૦૦૦-૦૦		ટી.ડી.એસ.	૬૪૦૫૯-૦૦		
૬૪૯૦૦૦૦-૦૦		એડવાન્સ ટેક્સ	-----		
૧૨૪૦૦૦૦-૦૦		BOI ફોડ FDOD રીસીએબલ	૬૪૯૦૦૦૦-૦૦		
૪૧૮૭૩૨૮-૪૪		BOI ફોડ ક્રન્ટ રીસીએબલ	૧૨૪૦૦૦૦-૦૦		
૨૬૮૬૪-૬૫		BOI ફોડ FDOD ઈન્ટ.રીસીએબલ	૪૧૮૭૩૨૮-૪૪		
૨૬૮૬૪-૬૪		CGST રીસીએબલ	૮૮૬૫૮-૦૯		
૨૭૦૦૦૦૦-૦૦		SGST રીસીએબલ	૮૮૬૫૮-૦૮		
૧૩૦૬૧૦-૦૦		ઈન્કમ ટેક્સ ૨૦૧૭-૧૮ રીસીએબલ	૩૯૦૦૦૦૦-૦૦		
૧૪૫૯૩૧-૦૧		ડીફર્ડ ગીફ્ટ ખર્ચ	-----		
૨૦૬૨૦૦-૦૦		IGST રીસીએબલ	૨૩૨૮૨૧-૭૩		
		ડીફર્ડ ટેક્સ રીસીએબલ	૫૬૨૦૨૦-૦૦		૨૨૩૫૦૯૯૯-૩૪
		૧૪ નફા નુકશાન ખાતેથી લાવ્યા નુકશાન			
૪૦૫૭૮૧૧૦૦-૮૭		કુલ સરવાળો.....			૪૩૬૯૫૨૧૭૧-૦૪
૨૮૩૪૭૧૯-૦૦		ઓફ બેલેન્સીટ આઈટમ (DEAF RBI)			૩૧૩૫૬૨૩-૦૦
શંકરલાલ જીણાભાઈ પટેલ પોપટલાલ દલસુખભાઈ સુખડીયા સુનિતાબેન દિલીપભાઈ જયસ્વાલ ગીરીશકુમાર અમરતાલ પટેલ પોપટલાલ લક્ષ્મણદાસ મોદી		ડીરેક્ટર્સ બાબુભાઈ સોમાભાઈ પરમાર વિનોદચંદ્ર બુધાલાલ પટેલ નિમેશકુમાર જીવણલાલ પટેલ વિનોદભાઈ મીઠાલાલ પટેલ	પ્રોફેસનલ ડાયરેક્ટર અશોકકુમાર બાબુલાલ મોદી મયંકકુમાર પ્રવિણભાઈ પટેલ		
			સરલાબેન દલસુખભાઈ પટેલ (ચેરમેન) દિનેશકુમાર રમણલાલ પટેલ (વા. ચેરમેન)		

વડનગર નાગરિક સહકારી બેન્ક લિ; વડનગર.

● તા. ૩૧-૩-૨૦૨૬ ના વર્ષના નફા-નુકશાનનો હિસાબ ●

તા. ૩૧-૩-૨૦૨૫		અર્થ	તા. ૩૧-૩-૨૦૨૬	
રૂા.	પૈસા		રૂા.	પૈસા
૧૩૩૬૩૧૫૨-૦૧		વ્યાજ થાપણો અને કરજ ઉપર		૧૭૫૫૪૨૦૬-૨૦
૪૮૮૩૦૩૭-૦૦		પગાર ભથ્થા અને પ્રો. ફંડ		૪૮૦૯૩૭૫-૦૦
૮૦૬૩૨-૦૦		ભાડુ કરવેરા, વીમો, બત્તી, જનરેટર અર્થ વગેરે		૬૩૦૨૭-૩૮
---		લીગલ તથા વકીલ ફી / કસ્ટોડિયન ફી		૧૪૬૦૦-૦૦
૧૨૬૩૧-૬૫		પોસ્ટેજ તથા ફોન ચાર્જસ આંગડીયા અર્થ		૪૨૦૩-૫૬
૨૦૪૫૦૦-૦૦		ઓડીટ ફી, ટેક્ષ ઓડીટ		૩૮૧૦૦૦-૦૦
૧૫૩૧૮૭-૮૪		ઘસારો અને મિલકત મરામત		૧૪૨૪૨૯-૨૨
૮૭૮૩૭-૯૦		સ્ટેશનરી છપામણી, જાહેર ખબર		૯૪૧૮૬-૦૦
૩૧૫૦૭૬-૦૬		ડીપોઝીટ ઇન્સ્યોરન્સ પ્રીમીયમ		૩૮૯૯૭૪-૨૧
		અન્ય અર્થ :-		
૬૯૯૯૮-૦૦		બિલ્ડીંગ રીપેરીંગ અર્થ	૧૩૩૫૮૬-૪૦	
૧૮૮૨૩૩-૦૦		કન્ટીજન્સી અર્થ	૧૭૮૩૩૨-૦૦	
૫૯૩૯૦-૦૦		સભા. ફી, લવા. ડેલી. ન્યુઝ પેપર લવા. ટ્રેનીંગ ફી	૮૫૮૦૦-૦૦	
૧૭૬૫૨-૦૦		સરભરા અર્થ	૨૫૯૨૪-૦૦	
૧૧૦૯૦૫૪-૦૦		મીની ડીપો. કમીશન	૧૧૨૨૨૨૦-૦૦	
૭૫૦૦૦૦-૦૦		પ્રોવીઝન (એન.પી.એ.)	---	
---		પ્રોવીઝન (ઈન્વેસ્ટમેન્ટ ડેપ્રીએશન)	૧૩૩૬૭૫૦-૦૦	
૨૨૭૩૯૩-૦૦		ગ્રેજ્યુઈટી પ્રિમીયમ	૨૪૨૨૦૪-૦૦	
૩૧૫૭૩૩-૯૭		કોમ્પ્યુટર કન્સલ્ટ ફી	૪૯૧૧૬૮-૭૭	
૫૩૨-૯૫		CGST અર્થ	---	
૫૩૨-૯૫		SGST અર્થ	---	
૫૦૦૦૦-૦૦		કન્સલ્ટન્સી ફી	---	
૨૦૦૦૦૦-૦૦		કોમ્પ્યુટર એન્ડ ટેકનોલોજી પ્રોવિઝન	---	
૧૦૬૯૩૦-૦૦		શેર હોલ્ડર ગીફ્ટ આર્ટીકલ અર્થ	૧૮૭૩૭૯૧-૦૦	૫૪૮૯૭૭૬-૧૭
૨૨૧૯૫૫૦૪-૩૩		અગાઉના વર્ષની ઇન્કમેટેક્સ ડીમાન્ડ	૧૧૦૦૦૦-૦૦	
૨૧૨૭૪૨-૦૦		ઇન્કમેટેક્સ એડવાન્સ ટેક્સ પ્રોવિઝનલ	૧૨૮૯૯૩૨-૦૦	૧૩૯૯૯૩૨-૦૦
૨૦૦૦૦૦૦-૦૦				
૬૨૪૧૯૩૯-૬૭		નફો સરવૈયામાં લઈ ગયા તે.		૩૫૯૬૮૨૬-૩૩
૩૦૬૫૦૧૮૬-૦૦				૩૩૯૩૯૮૩૬-૦૭

અમારા આજ તારીખનો રીપોર્ટ અને સામાન્ય શેરો ભાગ-૨ ને આધીન
 વડનગર અશ્વિન કે. યાજ્ઞિક એન્ડ કું. (સી.એ.) હરેશ ડી. મોદી
 તા. ૨૮-૦૫-૨૦૨૬ મહેસાણા ઈન્ચાર્જ મેનેજર
 મેમ્બર નં. ૧૮૧૨૧૩

વડનગર નાગરિક સહકારી બેન્ક લિ; વડનગર.

● તા. ૩૧-૩-૨૦૨૬ ના વર્ષના નફા-નુકશાનનો હિસાબ ●

તા. ૩૧-૩-૨૦૨૫		આવક	તા. ૩૧-૩-૨૦૨૬	
રૂા.	પૈસા		રૂા.	પૈસા
૨૯૦૪૪૮૧૬-૪૨		વ્યાજ અને વળતર ★ ★ ધીરાણ વ્યાજ આવક ૧૮૭૦૨૧૧૮-૧૫ એફડીઆર વ્યાજ આવક ૩૭૮૫૬૮૭-૭૦ ગવર્નમેન્ટ સિક્યુરીટી વ્યાજ ૮૭૭૨૫૮૮-૨૨ ૩૩૨૭૦૪૧૫-૦૭		૩૩૨૭૦૪૧૫-૦૭
૨૮૨૫૧-૮૨		કમીશન વટાવ અને દલાલી		૩૦૮૬૪-૦૦
---		સબસીડી અને ડોનેશન		---
---		બીન બેંકીંગ મિલ્કતોમાંથી અથવા		---
---		તેવી મિલ્કતોના વેચાણ કે હેરફેરમાં થયેલ આવક		---
---		ગવર્નમેન્ટ સીક્યુ નફો		---
		બીજી આવક :-		
૨૨૪૭૩-૫૦		ઈન્સીડેન્ટલ ચાર્જસ	૩૧૭૭૨-૦૦	
૨૩૩૧૨-૦૦		શેર ડીવીડન્ડ	૨૩૨૫૦-૦૦	
૧૬૦૩૦-૭૬		રીટર્નીંગ ચાર્જ	૧૩૦૬૪-૦૦	
૨૪૦-૦૦		સર્વિસ ચાર્જ	૪૦-૦૦	
૧૩૫૭૬૨-૦૦		સેફ ડીપોઝીટ લોકર	૧૮૩૯૮૧-૦૦	
૨૪૯૨૨-૦૦		ચેકબુક ચાર્જ / પાસબુક ચાર્જ	૩૦૬૦૦-૦૦	
૭૧૭૭-૫૦		એસ.એમ.એસ. ચાર્જ	-----	
૮૩૨૦૦૦-૦૦		એકસેસ આઈડીઆર પ્રોવિઝન ૨૪-૨૫	-----	
૫૧૫૨૦૦-૦૦		ડીફર્ડ ટેક્ષ ઈન્કમટેક્ષ પ્રોવિઝન	૩૫૫૮૨૦-૦૦	૬૩૮૫૫૭-૦૦
		નુકશાન સરવૈયામાં લઈ ગયા.		
૩૦૬૫૦૧૮૬-૦૦				૩૩૯૩૯૮૩૬-૦૭

ડીરેક્ટર્સ

શંકરલાલ જીણાભાઈ પટેલ

પોપટલાલ દલસુખભાઈ સુખડીયા

સુનિતાબેન દિલીપભાઈ જયસ્વાલ

ગીરીશકુમાર અમરતાલ પટેલ

પોપટલાલ લક્ષ્મણદાસ મોદી

બાબુભાઈ સોમાભાઈ પરમાર

વિનોદચંદ્ર બુધાલાલ પટેલ

નિમેશકુમાર જીવણલાલ પટેલ

વિનોદભાઈ મીઠાલાલ પટેલ

પ્રોફેસનલ ડાયરેક્ટર

અશોકકુમાર બાબુલાલ મોદી

મયંકકુમાર પ્રવિણભાઈ પટેલ

સરલાબેન દલસુખભાઈ પટેલ

(ચેરમેન)

દિનેશકુમાર રમણલાલ પટેલ

(વા. ચેરમેન)

વડનગર નાગરિક સહકારી બેન્ક લિ; વડનગર.

★ બેંક અંગેની વિશેષ માહિતી ★

ગ્રોસ એન.પી.એ. ૮૪.૪૦	૪.૪૫%	સી.ડી. રેશીયો	૫૬.૪૨%
નેટ એન.પી.એ. ૦૦.૦૦	૦૦.૦૦	સી.આર.એ.આર.	૨૪.૩૭%

- ★ SLR તેમજ CRR ની સતત જાળવણી ઉત્કૃષ્ટ લીકવીડીટી
- ★ કાર્યકારી ભંડોળ થાપણો અને અસ્કયામતો ઉપર ઉત્કૃષ્ટ નફા શક્તિ ધરાવતી બેંક.
- ★ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અમદાવાદ દ્વારા તા. ૩૧-૩-૨૦૨૫ આખરનું ઈન્સપેક્શન હાથ ધરવામાં આવેલ. બેંક ઈન્સપેક્શન દરમિયાન તેઓશ્રી તરફથી મળેલ સલાહ સુચનો માર્ગદર્શન પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવે છે.

● ગ્રાહકો જોગ વિનંતી ●

- ★ આર.બી.આઈ.ના આદેશ મુજબ MICR CHEQUE (Magnetic ink Character Recognition) નો ઉપયોગ ફરજિયાત કરવાનો હોઈ ખાતેદારોએ પોતાની નવીન ચેકબુક મેળવી તેનો ઉપયોગ કરવો.
- ★ સમાજનો નાનામાં નાનો માણસ પણ બેન્કીંગ સેવાનો લાભ મેળવી શકે તે હેતુસર આપણી બેંકમાં "૦" (ઝીરો) બેલેન્સથી No Frill બચત ખાતા ખોલવામાં આવે છે તેનો લાભ લેવા વિનંતી છે.
- ★ બેંક સાથેના વ્યવહાર કરતા ગ્રાહકો તેમજ સભાસદોના સેવિંગ્સ ખાતા હોવા ફરજિયાત છે. આપનું સેવિંગ્સ ખાતું ન હોય તો ખોલાવી જવા વિનંતી છે.
- ★ તમામ સેવિંગ્સ / કરન્ટ ખાતા ધરાવનાર ખાતેદારોએ તેમના ખાતામાં વર્ષમાં (એપ્રિલ થી માર્ચ) એક વખત લેવડ-દેવડ કરવી ફરજિયાત છે. ★ લોકર ધારક પોતાનું સેવિંગ્સ ખાતું ખોલાવી જવા વિનંતી છે.
- ★ આપણી બેંકે GSC બેંક દ્વારા RTGS/NEFT સેવા આપે છે તેનો લાભ લેવા વિનંતી છે.

IFSCODE: GSCB 0 UVNGBL ★ BANK GST No. 24AAAJT1234B2ZP
Zero

- ★ બેંક બેલેન્સ જોવા માટે મિસકોલ સર્વિસ : 7490 811 411
- ★ QR કોડ સર્વિસ /BANL/1600 સીરીઝ મો. ૧૬૦૦૪૦૪૧૮૧ /IMPS*

★ પરીશિષ્ટ - ૧ ★

૩૧-૩-૨૦૨૫	વિગત	૩૧-૩-૨૦૨૬
૩૦૭૭૯૪-૦૦	ચૂકવવા પાત્ર ડીવીડન્ડ -૨૦૨૧-૨૨	---
૧૯૯૮૯૦-૦૦	ચૂકવવા પાત્ર ડીવીડન્ડ -૨૦૨૨-૨૩	૧૯૫૭૯૨-૦૦
૧૩૦૦૩૧-૦૦	ચૂકવવા પાત્ર ડીવીડન્ડ -૨૦૨૩-૨૪	૧૨૬૮૦૬-૦૦
---	ચૂકવવા પાત્ર ડીવીડન્ડ -૨૦૨૪-૨૫	૧૨૭૦૧૮-૦૦
૬૩૭૭૧૫-૦૦	ટોટલ	૪૪૯૬૧૬-૦૦

★ પરીશિષ્ટ - ૨ ★

૩૧-૩-૨૦૨૫	વિગત	૩૧-૩-૨૦૨૬
૨૧૯૮૧૮૯-૦૦	ગવર્ન. સિક્યુરીટી લેવા પાત્ર વ્યાજ	૨૧૮૨૭૯૧-૦૦
૧૨૬૮૨૫૯-૫૧	મહેસાણા અર્બન બેંક લેવા પાત્ર વ્યાજ	૧૧૬૭૪૯૫-૦૦
૧૭૩૧-૫૧	IDFC લેવા પાત્ર વ્યાજ	૧૬૪૬૧૬-૦૦
૧૪૪૫૭૮-૯૫	GSC લેવા પાત્ર વ્યાજ	૫૦૯૬૧-૦૦
૯૮૯૩૮-૩૫	મહેસાણા ડી.સે.કો.ઓપ. બેંક લેવા પાત્ર વ્યાજ	૩૬૩૭૦-૦૦
૭૧૩૭૪૪-૩૭	બેંક ઓફ બરોડા લેવા પાત્ર વ્યાજ	૪૨૨૭૧૪-૦૦
૧૭૪૨૩૧-૬૧	બેંક ઓફ મહારાષ્ટ્ર લેવા પાત્ર વ્યાજ	૧૭૫૩૮૨-૦૦
૪૫૯૯૬૭૩-૩૦	ટોટલ	૪૨૦૦૩૨૯-૦૦

વડનગર નાગરિક સહકારી બેન્ક લિ; વડનગર.

1.Regulatory Capital

a) Composition of Regulatory Capital -31-03-2026 (Amount in Lakh)

Sr No.	Particulars	2025-26 Current Year	2024-25 Current Year
1	Common Equity Tier 1 capital (CET 1)*/Paid up share capital and reserves@ (net of deductions,if any)	401.95	361.85
2	Additional Tier 1 capital*/Other Tier 1 capital@	0.00	0.00
3	Tier 1 Capital (i+ii)	401.95	361.85
4	Tier 2 Capital	77.34	26.77
5	Total Capital (Tier 1 + Tier 2)	479.29	388.62
6	Total Risk Weighted Assets(RWAs)	1967.06	1660.64
7	CET 1 Ratio (CET 1 as a percentage of RWAs)*/Paid up share capital and reserves as percentage of RWAs	20.43%	21.79%
8	Tier 1 (Tier 1 capital as a percentage of RWAs)	20.43%	21.79%
9	Tier 2 (Tier 2 capital as a percentage of RWAs)	3.93%	1.61%
10	Capital to Risk Weighted Assets Ratio 9(CRAR)(Total Capital as a percentage of RWAs)	24.37%	23.40%
11	Leverage Ratio*		
12	a) Government of India b) State Government (specify name)	NIL	NIL
13	Amount of Paid up equity capital raised during the year	NIL	NIL
14	Give list as per instrument type (perpetual non-cumulative preference share,perpetual debt instruments,etc.).Commercial banks (excluding RRBs)	NIL	NIL
15	Give list as per instrument type (perpetual noncumulative preference shares , perpetual debt instruments, etc.).Commercial Banks(excluding	NIL	NIL

2. Asset liability management

a) Maturity pattern of certain items of assets and liabilities-31-03-2026

Rs in lakhs

	Day 1	2 to 7 days	8 to 14 days	15 to 30 days	31 days to 2 months	Over 2 months and up to 3 months	Over 3 months and up to 6 months	Over 6 months and up to 1 year	Over 1 year and up to 3 years	Over 3 years and up to 5 years	Over 5 years	Total
Deposits	1282.61	56.76	28.94	53.70	123.52	158.45	453.67	655.00	542.72	2.33	0.57	3358.27
Advances	33.19	9.15	13.83	19.94	37.42	46.94	154.03	581.23	688.00	211.18	99.76	1894.67
Investments		30.00	0.00	0.00	20.00	0.00	117.07	86.92	31.22	109.32	1577.94	1972.47
Borrowings Foreign												
Currency Assets Foreign												
Currency Liabilities												

વડનગર નાગરિક સહકારી બેન્ક લિ; વડનગર.

b) Liquidity coverage ratio (LCR) (Amount in Lakh)

		Quarter ended -31-03-2026 (similarly, there will be column of each of the four quarters)	
		Total Un-weighted Value (average)	Total weighted value (average)
High Quality Assets			
1	Total High Quality Asstes (HQLA)		
cash Outflows			
2	Retail Deposits and deposits from small business customers, of which;		
a)	Stable deposits		
b)	Less stable deposits		
3	Unsecured whole sale funding of which;		
a)	operational deposits (all counter parties)		
b)	Non operational deposits (all counterparties		
c)	Unsecured Debt		
4	Secured whole sale funding		
5	Additional requirements of which;	NIL	
a)	Out flows related to derivative exposures and other collateral		
b)	Outflows related to loss of funding on debt products		
c)	Credit and liquidity facilities		
6	Other contractual funding obligations		
7	other contingent funding obligations		
8	Total cash Outflows		
Cash Inflows			
9	Secured lending (e.e. reverce repos)		
10	Inflows from fully performing exposures		
11	other cash inflows		
12	Total cash Inflows		
			Total Adjusted Value
13	Total HQLA		
14	Total Net Cash Outflows		
15	Liquidity Coverage Ratio (%)		

વડનગર નાગરિક સહકારી બેન્ક લિ; વડનગર.

NSFR Disclosure Template-31-03-2026 (Amount in Lakh)

(Rs. in Crore)		Unweighted Value by residual Maturity				Weighted value
		No maturity*	<6 months	6 months to <1 yr	≥ 1yr	
ASF Item						
1	Capital: (2+3)					
2	Regulatory Capital					
3	Other capital instruments					
4	Retail deposits and deposits from small business customers:(5+6)					
5	Stable deposits					
6	Less stable deposits					
7	Wholesale funding: (8+9)					
8	Operational deposits					
9	Other wholesale funding					
10	Other liabilities: (11+12)					
11	NSFR derivative liabilities					
12	All other liabilities and equity not included in the above categories		NIL			
13	Total ASF (1+4+7+10)					
RSF Item						
14	Total NSFR high-quality liquid assets (HQLA)					
15	Deposits held at other financial institutions for operational purposes					
16	Performing loans and securities: (17+18+19+21+23)					
17	Performing loans to financial institutions secured by Level 1 HQLA					
18	Performing loans to financial institutions secured by non-Level 1 HQLA and unsecured performing loans to financial institutions					
19	Performing loans to non-financial corporate clients,loans to retail and small business customers,and loans to sovereigns,central banks,and PSEs , of which:					
20	With a risk weight of less than or equal to 35% under the basel II stadarised Approach for credit risk					

વડનગર નાગરિક સહકારી બેન્ક લિ; વડનગર.

21	Performing residential mortgages, of which:					
22	With a risk weight of less than or equal to 35% under the Basel II standardised Approach for credit risk	NIL				
23	Securities that are not in default and do not qualify as HQLA, including exchange-traded equities					
24	Other assets: (sum of rows 25 to 29)					
25	Physical traded commodities, including gold					
26	Assets posted as initial margin for derivative contracts and contributions to default funds of CCPs					
27	NSFR derivative liabilities					
28	NSFR derivative liabilities before deduction of variation margin posted					
29	all other assets not included in the above categories					
30	off-balance sheet items					
31	Total RSF					
32	Net Stable Funding Ratio (%)					

વડનગર નાગરિક સહકારી બેન્ક લિ; વડનગર.

3. Investments

a) Composition of Investment Portfolio

As at...31-03-2026 (current year balance sheet date) (Amount in Lakh)

	Investments in India							Investments outside India				Total Investments
	Government Securities	Other approved Securities-(BANK FDR)	Shares	Debentures and Bonds-MUTUAL FUND	Subsidiaries and/or joint ventures	Others	Total investments in india	Government securities (including local authorities)	Subsidiaries and/or joint ventures	Others	Total Investments outside India	
Held to Maturity	817.30						817.30					
Less: Provision for non-performing investments (NPI)	0.00						0.00					
Net	817.30						817.30					
							0.00					
Available for Sale	725.13		6.55				731.68					
Gross							0.00					
Less: Provision for depreciation and NPI	61.58		1.50				63.08					
Net	663.55	0.00	5.05	0.00	0.00	0.00	668.60					
							0.00					
Held for Tading							0.00					
Gross							0.00					
Less: Provision for depreciation and NPI							0.00					
Net							0.00					
							0.00					
Total Investments	1542.43	0.00	6.55	0.00	0.00	0.00	1548.98					
Less:provision for non-performing investments							0.00					
Less:Provision for depreciation and NPI	61.58		1.50				63.08					
Net	1480.85	0.00	5.05	0.00	0.00	0.00	1485.90					

As at ...31-03-2025 (previous year balance sheet date)

	Investments in India							Investments outside India				Total Investments
	Government Securities	Other approved Securities	Shares	Debentures and Bonds	Subsidiaries and/or joint ventures	Others	Total investments in india	Government securities (including local authorities)	Subsidiaries and/or joint ventures	Others	Total Investments outside India	
Held to Maturity	768.98						768.98					
Less: Provision for non-performing investments (NPI)	0.00						0.00					
Net	768.98						768.98					
							0.00					
Available for Sale	725.13		1.55				726.68					
Gross							0.00					
Less: Provision for depreciation and NPI	29.73		1.50				31.23					
Net	695.40	0.00	0.05	0.00	0.00	0.00	695.45					
							0.00					
Held for Tading							0.00					
Gross							0.00					
Less: Provision for depreciation and NPI							0.00					
Net							0.00					
							0.00					
Total Investments	1494.11	0.00	1.55	0.00	0.00	0.00	1495.66					
Less:provision for non-performing investments							0.00					
Less:Provision for depreciation and NPI	29.73		1.50				31.23					
Net	1464.38	0.00	0.05	0.00	0.00	0.00	1464.43					

વડનગર નાગરિક સહકારી બેન્ક લિ; વડનગર.

b) Movement of Provisions for Depreciation and Investment Fluctuation Reserve-31-03-2026

(Amount in Lakh)		
	2026	2025
Particulars	Current Year	Current Year
i) Movement of provisions held towards depreciation on investments		
a) Opening balance	0.00	8.32
b) Add: Provisions made during the year	13.37	0.00
c) Less: Write-off / write back excess provisions during the year	0.00	8.32
d) Closing balance	13.37	0.00
ii) Movement of Investment Fluctuation Reserve		
a) Opening balance	29.73	12.16
b) Add: Amount transferred during the year	18.48	17.57
c) Less: Drawdown		
d) Closing balance	48.21	29.73

d) Non-SLR Investment portfolio

i) Non-performing non-SLR investments

AS ON 31-03-2026

(Amount in Rs. lakh)

Sr. No.	Particulars	Current Year	Previous Year
a)	Opening balance	28.66	28.66
b)	Additions during the year since 1st April	0.00	0.00
c)	Reductions during the above period	0.00	0.00
d)	Closing balance	28.66	28.66
e)	Total provisions held	28.66	28.66

વડનગર નાગરિક સહકારી બેન્ક લિ; વડનગર.

ii) Issuer composition of non-SLR investments-31-03-2026 (Amount in Lakh)

Sr. No.	Issuer	Amount		Extent of Private Placement		Extent of 'Below Investment Grade' Securities		Extent of 'Unrated' Securities		Extent of 'Unlisted' Securities	
1	2	3		4		5		6		7	
		Current Year	Previous Year	Current Year	Previous Year	Current Year	Previous Year	Current Year	Previous Year	Current Year	Previous Year
a)	PSUs-Mutual Fund	0	0	NIL							
b)	Fis										
c)	Banks	394.84	425.00								
d)	Private Corporates										
e)	Subsidiaries/ Joint Ventures										
f)	Others-share										
g)	Provision held towards depreciation	28.66	28.66								
	Total*	423.50	453.66								

e) Repo transactions (in Face value terms)

AS ON 31-03-2026

(Amount in Rs. Lakh)

	Minimum Outstanding during the year	Maximum outstanding during the year	Daily average outstanding during the year	Outstanding as on march 31
i) Securities sold under repo a) Government Securities b) Corporate debt securities c) Any other securities ii) Securities purchased under reverse repo a) Government Securities b) Corporate debt securities c) Any other securities	NIL			

વડનગર નાગરિક સહકારી બેન્ક લિ; વડનગર.

4. Asset Quality

a) Classification of advances and provisions held- 31-03-2026 (Amount in Lakh)

	Standard	Non-Performing				Total
	Total Standard Advances	Sub-standard	Doubtful	Loss	Total Non-Performing Advances	
Gross standard Advances and NPAs						
Opening Balance	1530.57	34.39	30.81	38.49	103.69	1634.26
Add: Additions during the year	279.70	0	45.87	4.07		329.64
Less: Reductions during the year*		34.20	26.89	8.14	0.00	69.23
Closing balance	1810.27	0.19	49.79	34.42	84.40	1894.67
*Reductions in Gross NPAs due to:						0
i) Upgradation						0
ii) Recoveries (excluding recoveries from upgraded accounts)						0.00
iii) Technical/ Prudential Write-offs						0.00
iv) Write-offs other than those under (iii) above						0.00
						0.00
Provisions (excluding Floating Provisions)						0.00
Opening balance of provisions held	0.00					0.00
Add: Fresh provisions made during the year	0.00					0.00
Less: Excess provision reversed/ Write-off loans						0.00
Closing balance of provisios held	0.00	0.00	0.00	0.00	0.00	0.00
						0.00

Net NPAs	NIL					
Opening Balance						
Add: Fresh additions during the year						
Less: Reductions during the year						
Closing Balance						
Floating Provisions						
Opening Balance						
Add: Additional provisions made during the year						
Less: Amount drean down during the year						
Closing balance of floating provisions						
Technical write-offs and the recoveries made thereon						
Opening balance of Technical/prudential written-off accounts						
Add: Technical/ Prudential write-offs duering the year						
Less: Recoveries made from previously technical/ prudential written-off accounts during the year						
Closing balance						0.00

As on..31/03/2026 (Amount in Lakh)

Ratios (in per cent)	Current Year	Previous Year
Gross NPA to Gross Advances	4.45%	6.34%
Net NPA to Net Advances	0	0
Provision coverage ratio	165.92	135.06

વડનગર નાગરિક સહકારી બેન્ક લિ; વડનગર.

b) Sector-wise Advances and Gross NPAs-31-03-2026

2026

2025

(Amount in Rs. lakhs)

Sr.no.	Sector	Current Year			Previous Year		
		Out-standing Total Advances	Gross NPAs	Percentage of Gross NPAs to Total Advances in that sector	Out-standing Total Advances	Gross NPAs	Percentage of Gross NPAs to Total Advances in that sector
i)	Priority Sector	1736.08	84.40	4.86%	1545.50	103.69	6.71%
a)	Agriculture and allied activities	5.71			22.60		
b)	Advances to industries sector eligible as priority sector lending	1182.34	45.11		1002.66	59.70	
c)	Services	102.82			68.42		
d)	Personal loans	445.21	39.29		451.82	43.99	
	Subtotal (i)	1736.08	84.40	0	1545.50	103.69	0
ii)	Non-priority Sector						
a)	Agriculture and allied activities	0.41			6.27		
b)	Industry	1.78			55.45		
c)	Services						
d)	Personal loans	156.4			27.04		
	Sub-total (ii)	158.59	0	0	88.76	0	0
	Total (i+ii)	1894.67	84.40	4.86%	1634.26	103.69	6.71%

c) Overseas assets, NPAs and revenue

As on..31-03-2026

(Amount in Rs. lakh)

Particulars	Current Year	Previous Year
Total Assets	nil	nil
Total NPAs	nil	nil
Total Revenue	nil	nil

વડનગર નાગરિક સહકારી બેન્ક લિ; વડનગર.

ii) Details of accounts subjected to restructuring

(Applicable to LABs, RRBs, and UCBs)

As on..31-03-2026

		Agriculture and allied activities		Corporates (excluding MSME)		Micro,Small and Medium Enterprise (MSME)		Retail (excluding agriculture and MSME)		Total	
		Current Year	Previous year	Current Year	Previous year	Current Year	Previous year	Current Year	Previous year	Current Year	Previous year
Standard	Number of borrowers									NIL	NIL
	Gross Amount (Rs crore)									NIL	NIL
	Provision held (Rs crore)									NIL	NIL
Sub-standard	Number of borrowers									NIL	NIL
	Gross Amount (Rs crore)									NIL	NIL
	Provision held (Rs crore)									NIL	NIL
Doubtful	Number of borrowers									NIL	NIL
	Gross Amount (Rs crore)									NIL	NIL
	Provision held (Rs crore)									NIL	NIL
Total	Number of borrowers									NIL	NIL
	Gross Amount (Rs crore)									NIL	NIL
	Provision held (Rs crore)									NIL	NIL

e) Divergence in asset classification and provisioning

(Not applicable to RRBs and UCBs)

AS ON ..31-03-2026

Sr. No.	Particulars	(Amount in Rs. lakh)
		Amount
1	Gross NPAs as on March 31, 20XX* as reported by the bank	
2	Gross NPAs as on March 31, 20XX* as assessed by the Reserve Bank of India	
3	Divergence in Gross NPAs (2-1)	
4	Net NPAs as on March 31, 20XX as reported by the bank	
5	Net NPAs as on March 31, 20XX as assessed by the Reserve Bank of India	
6	Divergence in Net NPAs (5-4)	
7	Provisions for NPAs as on March 31, 20XX as reported by the bank	
8	Provisions for NPAs as on March 31, 20XX as assessed by the Reserve Bank of India	
9	Divergence in provisioning (8-7)	
10	Reported Profit before provisions and contingencies for the year ended March 31, 20XX	
11	Reported Net Profit after Tax (PAT) for the year ended March 31, 20XX	
12	Adjusted (notional) Net Profit after Tax (PAT) for the year ended March 31, 20XX after the divergence in provisioning	

વડનગર નાગરિક સહકારી બેન્ક લિ; વડનગર.

f) Disclosure of transfer of loan exposures

(ii) In the Case of stressed loans transferred or acquired, the following disclosures should be made

AS ON...31-03-2026

(Amount in Lakh)

Details of stresses loans transferred during the year (to be made seperately for loans classified as NPA and SMA)			
(all amounts in Rs crore)	To ARCs	To permitted transferees	to other transferees (please specify)
No. of accounts	NIL	NIL	NIL
Aggregate principal outstanding of loans transferred	NIL	NIL	NIL
weighted average residual tenor of the loans transferred	NIL	NIL	NIL
Net book value of loans transferred (at the time of transfer)	NIL	NIL	NIL
Aggregate consideration	NIL	NIL	NIL
Additional consideration realized in respect of accounts transferred in earlier years	NIL	NIL	NIL
Details of loans acquired during the year			
(all amounts in Rs crore)	From SCBs, RRBs, UCBs, StCBs, DCCBs, AIFIs, SFBs and NBFCs including Housing Finance Companies (HFCs)	From ARCs	
Aggregate Principal outstanding of loans acquired			
Aggregate consideraion paid			
weighted average residual tenor of the loans acquired			

g) Fraud accounts

AS ON 31-03-2026 (Amount in Lakh)

	Current Year	Previous Year
Number of frauds reported	NIL	
Amount involved in fraud (Rs. crore)		
Amount of provision made for such frauds (Rs. LAKH)		
Amount of unamortised provision debited from other reserves as at the of the year (Rs. LAKH)		
Bank Of India fraud 2017/18 77.30		
Bank Of India fraud provision 77.30		
Bank Of India fraud interest provision 41.87		

વડનગર નાગરિક સહકારી બેન્ક લિ; વડનગર.

5. Exposures

a) Exposure to real estate sector

AS ON ..31-03-2026

(Amount in Rs. lakh)

Category	Current year	Previous Year
i) Direct exposure a) Residential Mortgages- Lending fully secured by mortgages on residential property that is or will be occupied by the borrower of that is rented. Individual housing loans eligible for inclusion in priority sector advances shall be shown seperately. Exposure would also include non-funf based (NFB) limits. b) Commercial Real Estate - Lending secured by mortgages on commercial real estate (office buildings, retail space multipurpose commercial premises, multifamily residential buildings, multitenanted commercial premises, industrial or warehouse space, hotels, land acquisition, development and construction,etc.). Exposure would also include non-fund based (NFB) limits; c) Investments in Mortgage-Backed Securities (MBS) and other securitized exposures- i) Residential ii) Commercial Real Estate ii) Indirect Exposure Fund based and non-fund-based exposures on National Housing Bank and Housing Finance Companies.	NIL	NIL
Total Exposure to Real Estate Sector		

વડનગર નાગરિક સહકારી બેન્ક લિ; વડનગર.

b) Exposure to capital market

AS ON..31-03-2026

(Amount in Rs. lakh)

Particulars	Current Year	Previous year
i) Direct investment in equity shares, convertible bonds, convertible debentures and units of equity oriented mutual funds the corpus of which is not exclusively invested in corporate debt;	N I L	N I L
ii) Advances against shares/ bonds/ debentures or other securities or on clean basis to individuals for investment in shares (including IPOs/ ESOPs), convertible bonds, convertible debentures, and units of equity oriented mutual funds;	N I L	N I L
iii) Advance for any other purposed where share or convertible bonds or convertible debentures or units of equity oriented mutual funds are taken as primary security;	N I L	N I L
iv) Advances for any other purposes to the extent secured by the collateral security of share or convertible bonds or convertible debentures or units of equity oriented mutual funds i.e. where the primary security other than shares / convertible bonds / convertible debentures / units of equity oriented mutual funds does not fully cover the advances	N I L	N I L
v) Secured and unsecured advances to stockbrokers and guarantees issued on behalf of stockbrokers and market makers;	N I L	N I L
vi) Loans sanctioned to corporates against the security of shares / bonds / debentures or other securities or on clean basis for meeting promoter's contribution to the equity of new companies in anticipation of raising resources;	N I L	N I L
vii) Bridge loans to companies against expected equity flows / issues;	N I L	N I L
viii) Underwriting commitments taken up by the banks in respect of primary issue of shares or convertible bonds or convertible debentures or units of equity oriented mutual funds;	N I L	N I L
ix) Financing to stockbrokers for margin trading;	N I L	N I L
x) All exposures to venture Capital Funds (both registered and unregistered)	N I L	N I L
Total exposure to capital market	NIL	NIL

વડનગર નાગરિક સહકારી બેન્ક લિ; વડનગર.

c) Risk category-wise country exposure

AS ON..31-03-2026				
Risk Category*	Exposure (net) as at 31-03-2026 (Current Year)	Provision held as at march... (Current Year)	Exposure (net) as at 31-03-2025 (Previous year)	Provision held as at march... (Previous Year)
Insignificant				
Low	5281		5615	
Moderately Low				
MEDIUM	6003		5911	
Moderately High	0			
High	83		80	
Very High				
Total	11367		11606	

d) Unsecured advances

AS ON..31-03-2026

(Amount in Rs. lakh)

Particulars	Current Year	Previous Year
Total unsecured advances of the bank such as charge over the rights, licenses, authority, etc. have been	352.56	353.40
Out of the above, amount of advances for which Intangible securities taken	Nil	Nil
Estimated value of such intangible securities	Nil	Nil

વડનગર નાગરિક સહકારી બેન્ક લિ; વડનગર.

6. Concentration of deposits, advances, exposure and NPAs

a) Concentration of deposits

AS ON..31-03-2026

(Amount in Rs. lakh)

Particulars	Current Year	Previous Year
Total deposits of the twenty largest depositors	431.91	382.14
Percentage of deposits of twenty largest depositors to total deposits of the bank	12.86%	12.23%

b) Concentration of advances*

(Amount in Rs. lakh)

Particulars	Current Year	Previous Year
Total advances to the twenty largest borrowers	367.11	344.44
Percentage of advances to twenty largest borrowers to total advances of the bank	19.38%	21.08%

c) Concentration of exposures**

(Amount in Rs. lakh)

Particulars	Current Year	Previous Year
Total exposure to twenty largest borrowers/customers	396.00	363.60
Percentage of exposure to the twenty largest borrowers/customers to the total exposure of the bank on borrowers/customers	20.90%	22.25%

d) Concentration of NPAs

	(Amount in Rs. lakh)	
	Current Year	Previous Year
Total Exposure to the top twenty NPA accounts	84.40	103.69
Percentage of exposures to the twenty largest NPA exposure to total Gross NPAs.	100.00%	100.00%

વડનગર નાગરિક સહકારી બેન્ક લિ; વડનગર.

7. Derivatives

a) Forward rate agreement/Interest rate swap

AS ON...31-03-2026

(Amount in Rs. lakh)

Sr. No.	Particulars	Current Year	Previous Year
i)	i) The notional principal of swap agreements	NIL	NIL
ii)	ii) Losses which would be incurred if counterparties failed to fulfil their obligations under the agreements	NIL	NIL
iii)	iii) Collateral required by the bank upon entering into swaps	NIL	NIL
iv)	iv) Concentration of credit risk arising from the swaps	NIL	NIL
v)	v) the fair value of the swap book	NIL	NIL

b) Exchange traded interest rate derivatives

(Amount in Rs. lakh)

Sr. No.	Particulars	Current Year	Previous Year
i)	Notional principal amount of exchange traded interest rate derivatives undertaken during the year (instrument wise)	NIL	NIL
ii)	Notional principal amount of exchange traded interest rate derivatives outstanding as on 31st march.....(instrument wise)	NIL	NIL
iii)	Notional principal amount of exchange traded interest rate derivatives outstanding and not 'highly effective' (instrument wise)	NIL	NIL
iv)	Mark to market value of exchange traded interest rate derivatives outstanding and not 'highly effective' (instrument wise)	NIL	NIL

c) Disclosure on risk exposure in derivatives

ii) Quantitative disclosures

AS ON..31-03-2026

(Amount in Rs. lakh)

Sr. No	Particular	current year		Previous Year	
		Currency Derivatives	Interest rate derivatives	Currency Derivatives	Interest rate derivatives
a)	Derivatives (NOTIONAL Principal Amount	NIL	NIL	NIL	NIL
	i) For hedging	NIL	NIL	NIL	NIL
	ii) For trading	NIL	NIL	NIL	NIL
b)	Marked to Market positions	NIL	NIL	NIL	NIL
	i) Asset (+)	NIL	NIL	NIL	NIL
	ii) Liability (-)	NIL	NIL	NIL	NIL
c)	Credit Exposure	NIL	NIL	NIL	NIL
d)	Likely impact of one percentage change in interest rate (100*PV01)	NIL	NIL	NIL	NIL
	i) on hedging derivatives	NIL	NIL	NIL	NIL
	ii) on trading derivatives	NIL	NIL	NIL	NIL
e)	Maximum and Minimum of 100*PV01 observed during the year	NIL	NIL	NIL	NIL
	i) on hedging	NIL	NIL	NIL	NIL
	ii) on trading	NIL	NIL	NIL	NIL

વડનગર નાગરિક સહકારી બેન્ક લિ; વડનગર.

8. Disclosures relating to securitisation

(Applicable to all SCBs, SFBs but excluding RRBs)

AS ON..31-03-2026

(Amount in Rs. lakh)

Sl. No.	Particulars	Mar 31 (Current Year)	Mar 31 (previous Year)
1	No of SPEs holding assets for securitisation transactions originated by the originator (only the SPVs relating to outstanding securitization exposures to be reported here)	NIL	NIL
2	Total amount of securitised assets as per books of the SPEs	NIL	NIL
3	Total amount of exposures retained by the originator to comply with MRR as on the date of balance sheet	NIL	NIL
	a) Off-balance sheet exposures	NIL	NIL
	• First loss		
	• Others		
	b) On-balance sheet exposures	NIL	NIL
	• First loss		
	• Others		
4	Amount of exposures to securitisation transactions other than MRR	NIL	NIL
	a) off-balance sheet exposures	NIL	NIL
	i) Exposure to own securitisations		
	• First Loss		
	• Others		
	ii) Exposure to third party securitisations		
	• First Loss		
	• Others		
	b) On-balance sheet exposures	NIL	NIL
	i) Exposure to own securitisations		
	• First loss		
	• Others		
	ii) Exposure to third party securitisations		
	• First loss		
	• Others		
5	Sale consideration received for the securitised assets and gain/loss on sale on account of securitisation	NIL	NIL

વડનગર નાગરિક સહકારી બેન્ક લિ; વડનગર.

6	Form and quantum (outstanding value) of service provided by way of, liquidity support, post-securitisation asset servicing,etc.	NIL	NIL
7	Performance of facility provided. Please provide separately for each facility viz. Credit enhancement, liquidity support, servicing agent etc. Mention percent in bracket as of total value of facility provided (a) Amount paid (b) Repayment received (c) Outstanding amount	NIL	NIL
8	Average default rate of portfolio observed in the past. Please provide breakup separately for each asset class i.e. RMBS, Vehicle Loans etc.		(may mention average default rate of previous 5 years)
9	Amount and number of additional/top up loan given on same underlying asset. Please provide breakup separately for each asset class i.e. RMBS, Vehicle Loans, etc.		
10	Investor Complaints (a) Directly/Indirectly received and; (b) Complaints outstanding		

9. Off balance sheet SPVs sponsored (which are required to be consolidated as per accounting norms

(Not Applicable to RRBs, LABs, PBs, and UCBs

AS ON..31-03-2026

Name of the SPV sponsored	
Domestic	Overseas
NIL	NIL

10. Transfers to depositor Education and Awareness Fund (DEA Fund)

AS ON..31-03-2026		(Amount in Rs. lakh)	
Sr. No.	Particulars	Current Year	Previous Year
i)	Opening balance of amounts transferred to DEA Fund	28.35	20.65
ii)	Add: Amounts transferred to DEA Fund during the year	3.27	7.85
iii)	Less: Amounts reimbursed by DEA Fund towards claims	0.26	0.15
iv)	Closing balance of amounts transferred to DEA Fund	31.36	28.35

વડનગર નાગરિક સહકારી બેન્ક લિ; વડનગર.

11. Disclosure of complaints

a) Summary information on complaints received by the bank from customers and

AS ON..31-03-2026

(Amount in Rs. lakh)

Sr. No.	Particulars	Previous Year	Current Year
	Complaints received by the bank from its customers	NIL	NIL
1	Number of complaints pending at beginning of the year	NIL	NIL
2	Number of complaints received during the year	NIL	NIL
3	Number of complaints disposed during the year	NIL	NIL
	3.1 Of which, number of complaints rejected by the bank	NIL	NIL
4	Number of complaints pending at the end of the year	NIL	NIL
	Maintainance complaints received by the bank from office of Ombudsman		
5	Number of maintainable complaints received by the bank from the office of Ombudsman	NIL	NIL
	5.1 Of 5, number of complaints resolved in favour of the bank by office of Ombudsman	NIL	NIL
	5.2 Of 5, number of complaints resolved through conciliation/meditation/advisories issued by Office of Ombudsman	NIL	NIL
	5.3 Of 5, number of complaints reslved after passing of awards by office of ombudsman against the bank	NIL	NIL
6	Number of Awards unimplemented within the stipulated time (other than those appealed)	NIL	NIL

Note: Maintainable complaints refer to complaints on the grounds specifically mentioned in integrated Ombudsman Scheme, 2021 (Previously Banking Ombudsman Scheme, 2006) and covered with the ambit of the Scheme

b) Top five grounds of complaints received by the bank from customers

AS ON..31-03-2026

(Amount in Rs. lakh)

Grounds of complaints, (i.e. compalints relating to)	Number of complaints pending at the beginning of the year	Number of complaints received during the year	% increase/decrease in the number of complaints received over the previous year	Number of complaints pending at the end of the year	Of 5, number of complaints pending beyond 30 days
1	2	3	4	5	6
Current Year					
Ground - 1	NIL	NIL	NIL	NIL	NIL
Ground - 2	NIL	NIL	NIL	NIL	NIL
Ground - 3	NIL	NIL	NIL	NIL	NIL
Ground - 4	NIL	NIL	NIL	NIL	NIL
Ground - 5	NIL	NIL	NIL	NIL	NIL
Others	NIL	NIL	NIL	NIL	NIL
Total	NIL	NIL	NIL	NIL	NIL
Previous Year					
Ground - 1	NIL	NIL	NIL	NIL	NIL
Ground - 2	NIL	NIL	NIL	NIL	NIL
Ground - 3	NIL	NIL	NIL	NIL	NIL
Ground - 4	NIL	NIL	NIL	NIL	NIL
Ground - 5	NIL	NIL	NIL	NIL	NIL
Others	NIL	NIL	NIL	NIL	NIL
Total	NIL	NIL	NIL	NIL	NIL

વડનગર નાગરિક સહકારી બેન્ક લિ; વડનગર.

12. Disclosure of penalties imposed by the Reserve Bank of India

Nil			

13. Disclosures on remuneration

(Applicable to Banking Companies, including Foreign Banks operating in india)			
		Amount in Rs. lakh	
Particulars		Current Year	Previous Year
Remuneration Paid to Whole Time Directors/ Chief Executive Officers		NIL	NIL

14. Other Disclosures

a) Business ratios

(Amount in Rs. lakh)

AS ON...31-03-2026	3/31/2026	3/31/2025
Particular	Current Year	Privious Year
i) Interest Income as a percentage to Working Funds	7.61%	7.16%
ii) Non-interest income as a percentage to Working Funds	0.15%	0.40%
iii) Cost of Deposits	5.55%	4.63%
iv) Net Interest Margin	4.20%	4.70%
v) Operating Profit as a percentage to Working Funds	1.14%	2.27%
vi) Return on Assets	0.85%	1.58%
vii) Business (deposits plus advances) per employees (in LAKH)	583.66	528.66
viii) Profit per employee (iRs lakhs)	4.00	6.93

વડનગર નાગરિક સહકારી બેન્ક લિ; વડનગર.

e) Provisions and contingencies

(Amount in Rs. lakh)

Provision debited to Profit and Loss Account	Current Year	Previous year
i) Provision for NPI	0	0
ii) Provision towards NPA	0.00	7.50
iii) Provision made towards Income Tax	14.00	22.13
iv) Other Provisions and Contingencies (with details)	13.37	2.00
	27.37	31.63

g) Payment of DICGC Insurance Premium

(Amount in Rs. lakh)

AS ON...31-03-2026

		3/31/2026	3/31/2025
Sr. No.	Particulars	Current Year	Previous Year
i)	Payment of DICGC Insurance Premium	2.33	2.22
ii)	Arrears in payment of DICGC premium		

વડનગર નાગરિક સહકારી બેન્ક લિ; વડનગર.

b) Liquidity coverage ratio (LCR) (Amount in Lakh)	
NIL	
NSFR Disclosure Template-31-03-2025 (Amount in Lakh)	
NIL	
e) Repo transactions (in Face value terms)	AS ON 31-03-2026
NIL	
c) Overseas assets, NPAs and revenue	As on..31-03-2026
NIL	
ii) Details of accounts subjected to restructuring(Applicable to LABs, RRBs, and UCBs)	
As on..31-03-2026	
NIL	
e) Divergence in asset classification and provisioning(Not applicable to RRBs and UCBs)	
As ON ..31-03-2026	
NIL	
f) Disclosure of transfer of loan exposures	AS ON...31-03-2026
NIL	
b) Exposure to capital market	AS ON..31-03-2026
NIL	
c) Risk category-wise country exposure	AS ON..31-03-2026
NIL	
c) Disclosur on Risk exposure in derivatives	AS ON..31-03-2026
NIL	
a) Forward rate agreement/Interest rate swap	AS ON...31-03-2026
NIL	
b) Exchange traded interest rate derivatives(Amount in Rs. lakh)	
NIL	
8. Disclosures relating to securitisationAS ON..31-03-2026 (Amount in Rs. lakh)	
NIL	
9. Off balance sheet SPVs sponsored (which are required to be consolidated as per accounting	
NIL	

For Ashvin K. Yagnik & Co.
Chartered Accountants
Firm Reg. No. 100710W

Date : 28-05-2026
Place : Vadnagar

Hareshbhai D. Modi
Incharge Manager

❀ વડનગર નાગરિક સહકારી બેન્ક લિ; વડનગર. ❀

❀ ઉત્તરોત્તર વિકાસના સોપાન ❀

	૨૦૨૧-૨૦૨૨	૨૦૨૨-૨૦૨૩	૨૦૨૩-૨૦૨૪	૨૦૨૪-૨૦૨૫	૨૦૨૫-૨૦૨૬
શેર ભંડોળ	૧૨૯૫૭૩૭૫	૧૩૨૭૨૭૨૫	૧૩૧૦૫૨૦૦	૧૨૬૩૩૩૫૦	૧૩૯૭૨૭૫૦
સભાસદ સંખ્યા	૭૯૧૬	૭૯૩૮	૭૩૪૧	૭૩૦૯	૭૩૪૯
રીઝર્વ ફંડ અને અન્ય ફંડ	૪૯૯૩૧૦૮૮	૫૧૪૭૯૩૪૫	૫૨૧૭૨૯૧૩	૫૭૮૪૪૧૮૧	૬૪૧૬૮૩૩૫
થાપણો	૨૯૫૪૨૯૧૭૩	૨૯૯૬૫૦૩૬૭	૩૧૧૭૫૧૧૮૯	૩૧૨૩૭૨૪૨૯	૩૩૫૮૨૭૩૬૫
ધીરાણ	૧૫૧૪૬૯૮૫૭	૧૬૦૬૦૨૨૫૬	૧૭૦૫૪૨૪૧૦	૧૬૩૪૨૬૦૪૩	૧૮૯૪૬૭૦૭૫
કામકાજનું ભંડોળ	૩૮૬૭૪૮૮૬૦	૩૯૫૬૬૩૨૦૭	૪૦૨૩૨૯૫૧૩	૪૦૫૭૮૧૧૦૧	૪૩૬૯૫૨૧૭૧
નફો	+૩૦૦૫૮૬૧	+૩૨૬૧૩૮૧	૬૨૬૫૬૦૯	૬૨૪૧૯૪૦	૩૫૯૬૮૨૬
ડીવીડન્ડ	૯%	૯%	૯%	૯%	★૯%
ઓડીટ વર્ગ	અ	અ	અ	અ	અ

★ સુચિત

રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના નિર્દેશો અનુસાર દરેક ખાતામાં CKYC NORMS નું પાલન કરવું જરૂરી હોઈ જે ખાતેદારોએ નીચે જણાવેલ પુરાવા રજૂ ન કરેલ હોય તેમને સત્વરે બેન્કમાં આવી પુરાવા રજૂ કરી જવા વિનંતી છે.

● નીચે દર્શાવેલા બધા જ પુરાવા બે કોપીમાં લાવવા.

(૧) પાસપોર્ટ સાઈઝના ત્રણ ફોટા (૨) આધાર કાર્ડ (૩) પાનકાર્ડ અથવા ફોર્મ નંબર ૬૦

● સરનામાના પૂરાવા (કોઈપણ એક)

(૧) ટેલીફોન બીલ (૨) લાઈટ બીલ (૩) વેરા પાવતી (૪) રેશન કાર્ડ (૫) આધારકાર્ડ

● ઓળખ માટેના પૂરાવા (કોઈપણ એક)

(૧) પાનકાર્ડ (૨) મતદાર કાર્ડ (૪) ડ્રાઈવીંગ લાયસન્સ (૪) પાસપોર્ટ (૫) આધારકાર્ડ

● કરન્ટ ખાતુ ધરાવતા ગ્રાહકોએ ઉપરના પુરાવા ઉપરાંત પોતાના ધંધાનો તથા તેના સ્થળનો પુરાવો રજૂ કરવાનો રહેશે. તથા ગ્રુ.એસ.ટી નંબર હોય તો રજીસ્ટ્રેશનની વિગત આપવાની રહેશે.

● ઉપર મુજબના તમામપુરાવા જે ગ્રાહકોના બાકી હોય તે ગ્રાહકોએ સત્વરે આપી જવા વિનંતી છે. અન્યથા બેન્કની સુચના મુજબ જે ખાતામાં પુરાવા નહિ આવેલ હોય તે ખાતામાં લેવડ-દેવડ સ્થગિત કરવામાં આવશે જેની નોંધ લેવા નમ્ર વિનંતી.

બેન્કમાં બાંધી મુદતની થાપણો ઉપર રૂ. ૫૦,૦૦૦/- (સીનીયર સીટીઝન માટે રૂ. ૧,૦૦,૦૦૦/-) કે તેથી વધારે વ્યાજની રકમપર ૧૦% લેખે TDS લાગુ પડે છે. TDS ન કપાય તે માટે, થાપણદારે PAN કાર્ડની નકલ તેમજ ફોર્મ નં. 15H / 15G નાણાંકીય વર્ષની શરૂઆતમાં બેન્કમાં આપવું જરૂરી છે. PAN ન ધરાવતા થાપણદારોનો ઈન્કમેટેક્સ નિયમમુજબ ૨૦% લેખે TDS કપાતો હોઈ વહેલામાં વહેલી તકે બેન્કમાં PAN કાર્ડની નકલ જમા કરાવવા વિનંતી છે. ફોર્મ નહીં આપનાર થાપણદારોનો TDS કપાઈ જશે જે અંગે બેન્ક સર્ટીફિકેટ આપશે. TDS કપાયા પછી બેન્કની કોઈ જવાબદારી રહેશે નહીં.

● આપને માટે ●

૧. આ બેન્કના ડિરેક્ટર્સ બોર્ડના સભ્યશ્રીઓ એ યાદ રાખવાનું કે : તમે લોકોની થાપણોના ટ્રસ્ટી છો અને આ બેન્ક એ માત્ર સેવાનું સાધન છે. ૨. આ બેન્કના સભાસદો તરીકે આપણે યાદ રાખવાનું કે : આ બેન્કમાં ઘાલખાદ મુદતવીતી બાકીનું ખાતુ ન પડવું જોઈએ. ૩. આ બેન્કના ગ્રાહકોએ યાદ રાખવાનું કે : બેન્ક સાથે ની લેવડદેવડ ખુબ જ ચોખ્ખી અને નિયમિત રાખવી જોઈએ. ૪. આ બેન્કના કર્મચારીઓએ યાદ રાખવાનું કે : બેન્કનો વહીવટ ખુબ જ કરકસરથી કરવાનો છે. માયાળું વર્તન અને સારી સેવા બેન્કની મુડી બનશે.

આ બેન્કમાં મુકાયેલ રૂ. ૫,૦૦,૦૦૦/- સુધીની ડિપોઝીટ “ડિપોઝીટ ઈન્સ્યુરન્સ સ્કીમ” હેઠળ સુરક્ષિત છે.

● સભાસદો જોગ વિનંતી... ●

- (૧) આપણી સંસ્થાને આપણી સંસ્થા માનીને થાપણો વધારવા પ્રગતિશીલ રહો.
- (૨) સંસ્થામાં થાપણો મૂકો અને સગા-સંબંધીઓ પાસે મુકાવો.
- (૩) આપણું ધિરાણ અરજી ફોર્મ પુરેપુરું ભરી કાગળો (જેવાકે સરવૈયું, નફા-નુકશાન ખાતાનું પત્રક, વેપાર ખાતાઓના ઉતારા, ઇન્કમેટેક્સ-સેલેટેક્સના ઠરાવો, મિલ્કતનો દાખલો વિ.) સાથે જ બેન્કમાં રજુ કરવાનો આગ્રહ રાખો.
- (૪) ધિરાણની રકમ તથા વ્યાજ નિયમિત જમા કરાવો.
- (૫) આપણા ધિરાણ ખાતાઓમાં નિયમ અનુસાર જરૂરી ટર્નઓવર અવશ્ય થાય તે માટે કાળજી રાખશો.
- (૬) આપ જેના જમીન થયા હોય તેમની પાસે બેન્કનું ઓવરડ્રયુઝ (લહેણું) પડે ત્યારે સક્રિય બની વસુલાત થાય તે માટે તમામ પ્રયત્નો કરશો.
- (૭) આપ કોઈના જમીન થવા ન માગતા હોય ત્યારે તે બાબત આપ જાતે જ નક્કી કરશો, બેન્કના અધિકારીઓને વચ્ચે લાવવાનો પ્રયત્ન કરશો નહીં.
- (૮) ધિરાણ માગતી વખતે આપના માટે જમીન મેળવવાની કામગીરી આપ જાતે જ કરશો, બેન્કના કર્મચારીઓને વચ્ચે લાવવાનો પ્રયત્ન કરશો નહીં.
- (૯) બેન્કમાંથી કરજ લેનાર સભાસદોને તેમની સગવડની ખાતર પાકતી તારીખની ખબર આપવામાં આવે છે કારણસર ખબર ન અપાય તો બેન્ક જવાબદાર નથી.
- (૧૦) જમીનદારો સ્વેચ્છાએ જમીન થતા હોઈ લોન લેનાર જેટલી જવાબદારી તેઓની રહે છે. જેથી લોન નિયમિત ભરપાઈ થાય છે કે કેમ તેની કાળજી રાખવી જરૂરી છે.
- (૧૧) બેન્કમાં નોંધવામાં આવેલ સરનામામાં ફેરફાર થયો હોય તો તુરત જ બેન્કને લેખિત જાણ કરી જરૂરી ફેરફારની નોંધ કરાવવી આવશ્યક છે.
- (૧૨) બેન્કીંગ કામકાજમાં આપને તકલીફ પડે તો ઇન્ચાર્જ મેનેજરશ્રી નો સંપર્ક સાધવો.

તા.ક. : બેન્ક સાથે આપના વ્યવહારમાં વારસદાર નિમવા, શેર સર્ટીફિકેટ અને ડીવીડન્ડ વૉરંટ લઈ જવા વિગેરે કામો બાકી હોય તે સત્વરે પતાવો.

સુચનાઓ :

૧. કરજદારના ખાતામાં દર માસ (ફીક્સ ડીપોઝીટ સામેના ધીરાણ સિવાય) આખરે વ્યાજ ઉધારવામાં આવે છે. તો તે પછીના બીજા માસની પાંચમી તારીખ સુધીમાં વ્યાજની રકમ સૂચના મળે કે ન મળે તો પણ ભરી દેવી ફરજિયાત છે.
૨. વાહન વીમાની પોલીસી બેન્કમાં સમયસર રજુ કરવી, હાઈપોથીકેશન ધીરાણ હોય તો સ્ટોક સ્ટેટમેન્ટ દર માસે નિયમિત મોકલવું.
૩. સેવિંગ્સ ખાતાની લેવડ દેવડ વખતે સેવિંગ્સ ખાતાની પાસબુક અવશ્ય સાથે રાખવી.
૪. જે લોકર ધારકોના સેવિંગ્સ ખાતા ન હોય તેઓએ બેન્કમાં આવી સેવિંગ્સ ખાતું ખોલાવી જવું.

હરેશ ડી. મોદી
ઇન્ચાર્જ મેનેજર
વડનગર નાગરિક સહકારી બેન્ક લિ;

(Printed Matter)
BOOK-POST

પ્રતિશ્રી,

સરનામું.



From :

વડનગર નાગરિક સહકારી બેન્ક લિ;

નાની માતોર, વડનગર - ૩૮૪ ૩૫૫

જી. મહેસાણા. (ઉ. ગુજરાત)

મો. ૯૩૧૬૫ ૬૫૮૧૫

E-mail : info@vadnagarbank.com